

November-December, 2020



Budget-2021





મેઘમણી અપનાવો, સમૃદ્ધિ લાવો



મેઘમણી દ્વારા ઉત્પાદિત ઉત્કૃષ્ટ પાક સંરક્ષણ ઉત્પાદનો

જંતુનાશક



મેગાસ્ટાર	એસિફેટ ૭૫% એસ.પી.
કરેજ	ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮% એસ. એલ.
પ્રોટેક્ટ	ઇમિડાક્લોપ્રિડ ૭૦% ડબલ્યુ. એસ.
એવાર્ડ	એસિટામિપ્રિડ ૨૦% એસ. પી.
મેગાબાન	ક્લોરપાયરીફોસ ૨૦% ઈ.સી.
ટૂગો	ટ્રાઇગોફોસ ૪૦% ઈ.સી.
સિનજી	ક્લોર ૫૦% + સાયપર ૫% ઈ.સી.
મેગાથિન	સાયપરમેથિન ૧૦% ઈ.સી.
મેગાસાયપર	સાયપરમેથિન ૨૫% ઈ.સી.
લેજન્ડ	આલ્ફામેથિન ૧૦% ઈ.સી. અને એસ.સી
શોગન	લેમ્ડાસાયહેલોથિન ૨.૫% ઈ.સી.
શોગનપંચ	લેમ્ડાસાયહેલોથિન ૫% ઈ.સી.
મેગામોનો	મોનોકોટોફોસ ૩૬% એસ. એલ.
સાયપરટોન	ઇથિયોન ૪૦% + સાયપર ૫% ઈ.સી.
લેજન્ડ પ્લસ	ક્લોર ૧૬% + આલ્ફા ૧% ઈ.સી.
વેટ-૫૦	કારટેપ હા. ક્લોરાઇડ ૫૦% એસ.પી.
ઇન્નોવા	ઇન્ડોક્સાકાર્બ ૧૪.૫% એસ.સી.
વેટ-૪૭	કારટેપ હા. ક્લોરાઇડ ૪% જી.
કરેક્ટ	પ્રોફેનો ૪૦% + સાયપર. ૪% ઈ.સી.
ટૂગો સુપર	ડેલ્ટા ૧% + ટ્રાયજો ૩૫ % ઈ.સી.
મેગાકલેમ	ઇમામેકિટન બેન્ઝોએટ ૫% એસ.જી.
પ્રોપન	પ્રોફેનોફોસ ૫૦% ઈ.સી.
ડીવાઇન	ડી.ડી.વી.પી. ૭૬% ઈ.સી.
કેશ	આલ્ફામેથિન ૫% વે.પા.
થીમ	થાયમેથોક્સામ ૨૫% ડબલ્યુ. જી.

કન્ટ્રોલ	હેકઝાકોનાર્ગલ ૫% ઈ.સી.
કન્ટ્રોલ ટોટલ	હેકઝાકોનાર્ગલ ૫% એસ.સી.
ટાઇડ	પ્રોપિફોનાર્ગલ ૨૫% ઈ.સી.
મિલસ્ટિન	કાર્બેન્ડાઝિમ ૫૦% વે.પા.
મિલગેબ	મેન્કોગેબ ૭૫% વે. પા.
પ્રોફિટ	ટ્રાઇસાયક્લોર્ગલ ૭૫% વે.પા.
મિલવેટ	સલ્ફર ૮૦% ડબલ્યુ. ડી.જી.
ટીમ	કાર્બેન્ડાઝિમ ૧૨%+ મેન્કોગેબ ૬૩% વે.પા.
મિલટોપ	થાયોફીનેટ મિથાઇલ ૭૦% વે.પા.

ફૂગનાશક



નિંદામણનાશક

મિલગિન	એટ્રાઝિન ૫૦% વે.પા.
પેન્ડિલિન	પેન્ડિમેથાલિન ૩૦% ઈ.સી.
પ્રતીક	સલ્ફોસલ્ફ્યુરોન ૭૫% ડબલ્યુ. જી.



મેઘમણી ઑર્ગેનિક્સ લિમિટેડ

“મેઘમણી હાઉસ”, સફલ પ્રોફિટિયરની પાછળ, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ.
ફોન : ૦૭૯-૭૧ ૭૬ ૧૦૦૦, ૨૯૭૦૯૬૦૦ ફેક્સ : ૦૭૯-૨૯૭૦ ૯૬૦૫.
E-mail : helpesk@meghmani.com Web Size : www.meghmani.com



Leading From The Front

President

Natubhai Patel

Sr. Vice President

Hemant Shah

Vice President

K. I. Patel

Hon. Secretary

Pathik Patwari

Hon. Secretary (Regional)

V. P. Vaishnav

Hon. Treasurer

Sachin Patel

Immediate Past President

Durgesh Buch

Contents

Team GCCI Message.....	03
Visit By Office Bearers	05
GCCI in Action	06
Union Budget-2021	23
Membership Renewal Fees Information.	53
National & International Trade Fairs	54
Congratulations	57
Important Information.....	58
Regional Chambers Activities	61
Action Taken	67
Representations	68

Gujarat Chamber of Commerce & Industry,
Ashram Road, P. O. Box No. 4045,
Ahmedabad - 380 009.
Tel.: +91 79 26582301 / 2 / 3 / 4,
Email: gcci@gujaratchamber.org,
Web.: www.gujaratchamber.org

We welcome your feedback and suggestions.
Do write to us on :
bulletin@gujaratchamber.org
Per Copy: ₹18/-

CSR: Much More than Statutory Obligation



Business or otherwise! Reliance is the front runner Indian private sector company. Known for its business acumen and achievements, RIL is also on the forefront in paying back to the society. While education, health, heritage, sustainable development and rural empowerment form the core areas of CSR at RIL, the activities under these gamuts are unique and substantial. RIL has done much more when it comes to actual spending on CSR in India. Not only this, RIL also tops the list of CSR spending in the State of Gujarat. Our CSR initiatives have reached millions over the years and nearly 4,00,000 people benefit from our continuing programmes every year under stewardship of our Chairman & Managing Director Shri Mukesh D. Ambani and Chairperson of Reliance Foundation Smt. Nita M. Ambani.



Where CSR is constantly being redefined!


Reliance
Industries Limited
Growth is Life

Team GCCI Message

સ્નેહી મિત્રો,

વર્ષ ૨૦૨૧ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે સૌ તેમજ સમગ્ર વિશ્વ માટે વર્ષ ૨૦૨૦ એક ખૂબ જ પડકારરૂપ સાબિત થયું, પરંતુ એક નિતાંત સત્ય એ બાબત છે કે પડકારરૂપ પરિસ્થિતિ થકી જ નવીનતમ શોધખોળ તેમજ જીવન જીવવાની નવી શૈલી આકાર લેતી હોય છે. ‘કોવિડ-૧૯’ ના વિશ્વવ્યાપી પડકાર સામે વર્ષ ૨૦૨૦ દરમિયાન આપણે માત્ર આ વાઈરસ અંગેની વૈકસિન જ નથી શોધી, પરંતુ તેથી પણ વિશેષ આપણા સૌના જીવનમાં આમૂલ પરિવર્તન આવેલ છે અને તેમ કહી શકાય કે વિશ્વવ્યાપી રોગચાળાના ભવિષ્યના આવા કોઈ પણ પડકાર સમક્ષ આપણે હવે વધુ સુસજ્જ બનેલ છીએ.

જ્યારે જ્યારે આપણી સમક્ષ અકલ્પનીય પડકાર આવે છે ત્યારે બે બાબત બનતી હોય છે: “Creative Destruction” & “Adapting towards a New Way of life”. કોરોના વાઈરસના સંદર્ભમાં આપણે સૌએ સમગ્ર માનવ સમાજે પ્રદર્શિત કરેલ “Resilience” સ્થિતિસ્થાપકતા ખરેખર દાદ માગી લે તેમ છે અને આગામી સમયમાં ચોક્કસ આ આપણી તાકાત બની રહેશે.

કોરોના મહામારીનો ભારતીય સંદર્ભમાં વિચાર કરીએ તો આપણા પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્ર સમક્ષ રજૂ કરેલ “આત્મનિર્ભર ભારત”ની ચોક્કસપણે વાત કરવી પડે. “આત્મનિર્ભર ભારત”નો આ વિચાર તેમજ તેનું સમગ્ર પેકેજ કોરોનાની કટોકટીને એક આર્થિક ઉજ્જવળ તકમાં ફેરવવાની વાત છે અને વર્ષ ૨૦૨૧ દરમિયાન આપણે સૌ “આત્મનિર્ભર ભારત” પેકેજનું અમલીકરણ પણ જોઈ શકીશું તેમજ આપણા વ્યાપાર-ઉદ્યોગ-વ્યવસાય થકી તેના ભાગીદાર પણ બની શકીશું.

મિત્રો, આપણા સૌ માટે આનંદ તેમજ ગર્વ લેવા જેવી બાબત એ છે કે કોરોના મહામારીના પડકાર છતાંય આપણી અનેકવિધ પ્રવૃત્તિઓ યથાવત્ રહેલ છે અને તેમાં ખાસ સમાવેશ થાય છે આપણા દ્વારા સરકારશ્રી તેમજ અલગ અલગ અધિકારીશ્રીઓ સમક્ષ કરાયેલ વ્યાપાર-વ્યવસાયના હિતમાં અલગ-અલગ રજૂઆતો તેમજ તે અંગે મેળવેલ સુંદર પરિણામ.

GCCI દ્વારા આપણે ગુજરાત સરકારના “ગુજરાત ટેનન્સી તથા એગ્રિકલ્ચરલ લેન્ડ એક્ટ”ની ૬૩ AAA અંગેની જોગવાઈઓ, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે અમલી બનાવવા તેમજ GDCR માં ફેરફાર કરી એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં યુનિટ સાઈઝમાં ફેરફાર કરવા તેમજ ફ્લોર હાઈટની મર્યાદા હટાવવા વગેરે રિયલ એસ્ટેટના પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવી. મુખ્ય મંત્રીશ્રીને આપણે રાજ્યમાં ખેડૂત બજારની સ્થાપના માટે

ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જોગવાઈ અંગે પણ પત્ર પાઠવેલ તથા ટેક્સટાઈલ તેમજ અન્ય પ્રોસેસ હાઉસીસને સીલ કરવાના મુદ્દા પર રજૂઆત પાઠવેલ. મુખ્યમંત્રીશ્રીને આપણે કચ્છ વિસ્તારને ફર્નિચર માટેના હબ તરીકે વિકસાવવા માટે પણ સૂચનો પાઠવેલ છે.

અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ ઔદ્યોગિક એકમો માટે NOC/લાઈસન્સની પરવાનગી મેળવવા બાબતે પણ આપણે અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટને પત્ર પાઠવેલ.

તે જ પ્રમાણે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વેપારીઓના જનરલ ઈન્વેસ્ટિગેશનની બાબતો આ સમય દરમિયાન હાથ ન ધરવા અંગે પણ આપણે ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સીસ શ્રી જે. પી. ગુપ્તાને આપણી રજૂઆત પાઠવેલ.

દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૧૨ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા મંજૂરી પાઠવવા માટે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાને પણ આપણે પત્ર પાઠવેલ.

આ ઉપરાંત સરકારશ્રી સાથે આપણો સંપર્ક જાળવી રાખવાના આશયથી આપણે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ગૃહ મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા વગેરેની શુભેચ્છા મુલાકાત લીધી. આ ઉપરાંત આપણે કેન્દ્રીય શિપિંગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સાથે પણ મિટિંગ કરેલ.

GCCIના હોદ્દેદારોએ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ, શ્રી મનસુખભાઈ માંડવિયા તથા સંસદસભ્ય શ્રી મનોજ તિવારીજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ તેમને આપણી પ્રવૃત્તિઓ વિષે માહિતી પણ આપી હતી.

કેન્દ્રીય નાણાં મંત્રીશ્રી માનનીય નિર્મલા સીતારામન સમક્ષ ફેસલેસ અપીલ સ્કીમ-૨૦૨૦ અંતર્ગત કરદાતાઓને વ્યક્તિગત હિયરિંગની તક આપવા માટે આપણે રજૂઆત પાઠવી આપેલ.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી સાથે પણ આપણે મિટિંગ કરેલ, જેથી ઉદ્યોગને લગતા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. તે જ પ્રમાણે આપણે ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સીસ મિસ. સીમા અરોરાની પણ સૌજન્ય મુલાકાત કરી.

ગત સમયમાં આપણી ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી તેમજ હેલ્થ વિભાગના ડાયરેક્ટર શ્રી પી. એમ. શાહ, ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમેટેક્સ શ્રી અમિત જૈન વગેરે સાથે પણ મુલાકાત થઈ. કોરોના મહામારીના સંદર્ભમાં જ આપણે વ્યાપાર-વ્યવસાયમાં તકેદારી તેમજ સલામતીનાં અનેકવિધ પગલાં અંગે એક મિટિંગ ૨૭ જેટલાં અલગ-અલગ વ્યાપારી એસોસિયેશન તેમજ મહાજનોને સાથે લઈ અમદાવાદ પોલીસ ઝોન-૨ તેમજ ૭ના નાયબ પોલીસ કમિશનરશ્રીઓ શ્રી વિજયભાઈ પટેલ તેમજ શ્રી પ્રેમસુખભાઈ ડેલુ સાથે કરી.

આપણી ચેમ્બરના હોદ્દેદારોની ગુજરાત રાજ્યના ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરી તેમજ હેલ્થ વિભાગના ડાયરેક્ટર શ્રી પી. એમ. શાહ તેમજ GST કમિશનર શ્રી જી. પી. ગુપ્તા સાથેની મિટિંગ પણ ખૂબ જ સંતોષજનક રહી.

મને જણાવતાં આનંદ થાય છે કે આપણી અલગ-અલગ કમિટીઓ પણ તેમની પ્રવૃત્તિઓ અન્વયે ખૂબ જ કાર્યરત છે.

આપણી બિઝનેસ વિમેન વિંગ કમિટી દ્વારા પણ અનેકવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવેલ છે તેમજ આપણી યુથ વિંગ પણ ખૂબ જ પ્રવૃત્ત રહેલ છે. તેમને મારાં ખૂબ-ખૂબ અભિનંદન.

મિત્રો, કેન્દ્રીય વિકાસ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા પ્રસ્તુત કરેલ વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ પર આધારિત ગુજરાત ચેમ્બરનું આ ખાસ બુલેટિન આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે.

આજથી થોડાક સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ “આત્મનિર્ભર ભારત”ના રૂપિયા ૨૦.૮૭ લાખ કરોડના પેકેજને તીવ્ર વેગ આપતું આ અંદાજપત્ર છે જેમાં વ્યાપાર-ઉદ્યોગ-કૃષિ વિકાસના તમામ વિભાગો તો આવરી લેવામાં આવેલ છે, જ પણ સાથે સાથે કેન્દ્રીય સરકારશ્રીની ભારતના અર્થતંત્ર માટેની એક લોન્ગ ટર્મ વિઝનનો પરિચય થાય છે. ભારતીય અર્થતંત્રને-આત્મનિર્ભર ભારતને ૫ ટ્રિલિયન ડોલર તરફ લઈ જતું આ બજેટ છે. કોરોના પેડેમિક પછીના રીસેટ-મોડ સમાન આ બજેટ છે.

બજેટનાં અનેકવિધ પાસાં ધ્યાન ખેંચી લે તેવાં છે, જેમાં રૂપિયા ૫.૫ લાખ કરોડના કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, સરકારી બેન્કો માટે રૂપિયા ૨૦,૦૦૦ કરોડ, સ્વચ્છ ભારત મિશન-૨.૦ પરત્વે ૧.૪૧ લાખ કરોડ, જળ જીવન મિશન (અર્બન) અન્વયે ૪૩૭૮ શહેરોના ૨.૮૬ કરોડ પરિવારોને ઘરેલુ પાઈપ-લાઈન વ્યવસ્થા થકી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ રૂપિયા ૬૪,૧૮૦ કરોડ ફાળવવામાં આવેલ છે, જેનાથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે અને હેલ્થ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો ફાયદો થશે. સરકારશ્રીએ કોરોના વેક્સિનેશન માટે રૂપિયા ૩૫૦૦૦ કરોડ ફાળવેલ છે.

કેન્દ્રીય સરકારશ્રીની ઉજ્જવળ યોજના હેઠળ એક કરોડ વધુ ગેસ કનેક્શન પૂરાં પાડવામાં આવશે.

સરકારશ્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પરત્વે રૂપિયા ૧.૧૮ લાખ

કરોડ ફાળવેલ છે તેમજ “રાષ્ટ્રીય રેલ યોજના-૨૦૩૦” પરત્વે રૂપિયા ૧.૧૦ લાખ કરોડનું આયોજન કરેલ છે. રૂપિયા ૧૮૦૦૦ કરોડ સાર્વજનિક બસ પરિવહન હેઠળ ફાળવેલ છે જેનાથી ઓટોમોબાઈલ ઉદ્યોગને ચોક્કસ ફાયદો થશે તેમજ પાવર સેક્ટરમાં રૂપિયા ૩ લાખ કરોડથી વધુ યોજનાઓનો સમાવેશ કરેલ છે.

કેન્દ્રીય સરકારશ્રીના ગ્રીન ઊર્જા પરત્વેના કમિટમેન્ટના ભાગરૂપે “હાઈડ્રોજન એનર્જી મિશન”નું આયોજન કરેલ છે. આગામી ૩ વર્ષમાં ૧૦૦થી પણ વધુ શહેરોમાં પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડવાનું આયોજન છે.

શિક્ષણ ક્ષેત્રે ૧૫૦૦૦થી વધુ શાળાઓને આદર્શ શાળા બનાવવામાં આવશે. વંચિત વર્ગ માટે ૭૫૦ એકલવ્ય શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. ૧૦૦ નવી સૈનિક સ્કૂલોનું નિર્માણ કરવામાં આવશે. રૂપિયા ૩૦૦૦ કરોડ કેન્દ્રીય એગ્રીકલ્ટીવ ટ્રેનિંગ માટે ફાળવેલ છે. રૂપિયા ૫૦,૦૦૦ કરોડની કેન્દ્રીય સંશોધન ફાઉન્ડેશન માટે જોગવાઈ કરેલ છે.

ડિસેમ્બર-૨૦૨૧માં પ્રથમ માનવરહિત ઉપગ્રહ-માનવરહિત ગગનયાન મિશન પૂર્ણ કરવાનું સરકારશ્રીનું લક્ષ્ય છે.

કેન્દ્રીય અંદાજપત્રમાં કૃષિ ઉદ્યોગને અભૂતપૂર્વ વેગ આપી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની વાત છે, જે થકી ખેડૂતોની આવક વધારવા MSPમાં વધારો કરવામાં આવશે, ખેડૂતો માટે સુલભ ઋણ પૂરું પાડવા રૂપિયા ૧૬.૫ લાખ કરોડ ફાળવેલ છે. માઈક્રો ઈરિગેશન ફંડને બમણું કરેલ છે. નવા ૫ એગ્રિ હબ બનાવવામાં આવશે.

સમગ્ર બજેટને સુંદર પ્રતિભાવ મળેલ છે જેનાથી ચોક્કસ વ્યાપાર-ઉદ્યોગ-કૃષિ વગેરેને વેગ મળશે અને આપણું અર્થતંત્ર ખૂબ જ મજબૂત તેમજ સ્પર્ધાત્મક બનશે.

મિત્રો, આપણી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંગઠન શક્તિનું જીવંત ઉદાહરણ છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન કોરોના મહામારી સામેની વૈશ્વિક લડતમાં ફરી એક વખત યથાર્થ થયેલ છે કે સંગઠિત વિશ્વ કોઈ પણ પડકારનો સામનો કરવા સમર્થ છે.

વર્ષ ૨૦૨૧ દરમિયાન આપણી આ જ સંગઠિત શક્તિ અને આપણા “Spirit of Solidarity” થકી આપ સૌની સફળતા માટે પ્રાર્થના કરું છું.

નરુભાઈ પટેલ
પ્રમુખ

હેમંત શાહ
સિ.નિ. ઉપપ્રમુખ

કે. આઈ. પટેલ
ઉપપ્રમુખ

પથિક પટવારી
માનદ્-મંત્રી

વી. પી. વૈષ્ણવ
માનદ્-મંત્રી (રીજનલ)

સચીન પટેલ
માનદ્-ખજાનચી

Visit By Office Bearers



કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે ગુજરાત ચેમ્બરના હોદ્દેદારોની શુભેચ્છા મિટિંગ



લોકસભાના સાંસદ શ્રી મનોજ તિવારી સાથે ગુજરાત ચેમ્બરના હોદ્દેદારોની શુભેચ્છા મિટિંગ



ભારત સરકારના પોર્ટ, શિપિંગ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સાથે ચેમ્બરના હોદ્દેદારોની શુભેચ્છા મિટિંગ



રાજકોટ ખાતે કારોબારી સમિતિની મિટિંગ



રાજકોટ ખાતે રિજિનલ કાઉન્સિલની મિટિંગમાં ઉપસ્થિત રિજિનલ કાઉન્સિલના સભ્યો સાથે ચેમ્બરના હોદ્દેદારો

GCCI in Action

GCCI BWWC visit to DEEPKIRAN Industries - Dt. 03-11-2020



ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિંગ કમિટી દ્વારા તા.૩-૧૧-૨૦૨૦ના રોજ ટીપકિરણ ફૂડ્સ પ્રાઇવેટ

લિમિટેડ, વડસર ખાતે ઇન્ડસ્ટ્રી વિઝિટનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ કમિટીના સભ્યો એ સાણંદ ખાતે આવેલ થોળ લેકની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કમિટીના આવનારા પ્રોગ્રામ અંગે મિટિંગ કરી હતી. ત્યારબાદ તેઓએ વડસર ખાતે આવેલ ટીપકિરણ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. ટીપકિરણ ફૂડ્સ મુખ્યત્વે શાકાહારી ફોડન ફૂડ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જે વિદેશમાં એક્સપોર્ટ થાય અને તેની બધી જ આઈટમ ઘણી પ્રખ્યાત છે. કંપનીમાં મિસ. બીના પારેખે તેમને આવકાર્યા હતા તથા કંપનીમાં ગુણવત્તા અને એક્સપોર્ટને ધ્યાનમાં રાખી કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી. આ માહિતી સભ્યો માટે ખૂબ જાણકારીસભર હતી.

Awareness Webinar on Cyber Crime & Cyber Security - BWWC - Dt. 04-11-2020



તા.૪-૧૧-૨૦૨૦ના રોજ GCCIની બિઝનેસ વિમેન વિંગ કમિટી દ્વારા સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી ઉપર અવેરનેસ આપતા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબિનારનો મુખ્ય હેતુ મહિલાઓને રોજબરોજના ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ધંધા, સોશિયલ સાઈટમાં થતા વિવિધ છેતરપિંડી ફોડથી માહિતગાર કરવા તથા કયા પ્રકારની સાવચેતી રાખવી તેની માહિતી આપવાનો હતો.

વેબિનારમાં ચેમ્બરના પ્રમુખ શ્રી નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં જ્યારે આપણે ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે મહિલાઓ માટે સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા હોવી એ આવશ્યક છે.



આ વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અમિતભાઈ વસાવા, ડે. કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમ, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે પોતાના વક્તવ્યમાં કોઈ પણ પ્રકારે ફોડ થાય તો હેલ્પલાઈન નં. ૧૦૦ પર જાણ કરવા જણાવ્યું હતું તથા તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા કઈ રીતે તેનો ઝડપી ઉકેલ લવાય તેની માહિતી આપી હતી. હાલમાં મુખ્યત્વે KYC અપડેટના બહાને, સિમ સ્વેપિંગ, કેડિટકાર્ડ, ખોટા ક્રેડિટ કાર્ડ કેર નંબર ડાયલ કરવા લીધે, સાયબર બુલિંગ ઓટીપી, અસંગત ફાઈલ ડાઉનલોડ સાથે સંબંધિત છેતરપિંડી વિષે જણાવ્યું હતું અને આ બધાથી સાવચેત રહેવા માટે સિસ્ટમ અને ફોનમાં એન્ટિવાઈરસ અપડેટ, ફાયર વોલ સેટઅપ, બેઝિક

SPEAKERS Panel of Subject Experts



Mr. Amit Vasava
Deputy Commissioner of Police
Cyber Crime



Mr. K. V. Barot
President
Punjab National Bank
Staff Association Gujarat



Mr. Krapesh Bhatt
Cyber Security Analyst
Evolution Info Secure



Ms. Shruti Parikh
Network Engineer
DLS Internet Services
Chicago, USA

સાયબર સાવચેતી, ઈ-મેઈલ અને પેન ડ્રાઈવના વપરાશ, રેગ્યુલર પાસવર્ડ બદલવા વગેરે અંગે માહિતગાર કર્યા હતા. વેબિનારમાં વક્તા શ્રી કે.વી. બારોટ, પ્રેસિડેન્ટ, પંજાબ નેશનલ બેન્ક સ્ટાફ એસોસિયેશન અને વિવિધ પ્રકારના બેન્કિંગ ફોંડ અંગે જણાવ્યું હતું તથા તેનાથી બચવા માટે હંમેશાં સિસ્ટમ અને ફોનમાં ફાઈનાન્સને લગતી એપ્લિકેશનને લોગ આઉટ કરવી, જન્મ તારીખ અને જાણીતી તારીખનો પાસવર્ડ ના રાખવો, બેન્કિંગની SMS સુવિધા ચાલુ રાખવી, શંકાસ્પદ વ્યવહારોની બેન્કમાં જાણ કરવી, બિનજરૂરી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા માટે માહિતગાર કર્યા હતા.

વેબિનારના અન્ય વક્તા શ્રી કપેશ ભટ્ટ, સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ, ઈવોલ્યુશન ઈન્ફો સિક્યોર, સુરતથી જોડાયા હતા. તેમણે વિન્ડોઝ-૧૦નો ઉપયોગ કરવો તથા તેને ઓટો અપડેટ રાખવું, ચાઈનીઝ ડીવાઈસના ઉપયોગ વખતે માહિતી શેર ન

કરવા, કંપનીના કર્મચારીઓને સોફ્ટવેરના ઉપયોગ માટે મર્યાદિત અધિકાર આપવા વીગેરે જેવી નાની બાબતોનું ધ્યાન રાખી સાયબર કાઈમથી બચી શકાય છે તેમ કહ્યું હતું અને શંકાસ્પદ લાગતી ફાઈલોને વાઈરસમુક્ત કરવા www.virustotal.com વેબસાઈટ માટે પણ જણાવ્યું હતું.

મિસ શ્રુતિ પરીખ, નેટવર્ક એન્જિનિયર, DLS ઈન્ટરનેટ સર્વિસીઝ, શિકાગો, યુ.એસ.એ.થી વક્તા તરીકે હાજર રહ્યાં હતાં. જેમણે ભારતમાં વધી રહેલા સાયબર કાઈમની માહિતી આપી હતી અને કંપનીના કર્મચારીઓ માટે નિયમિત સાયબર સિક્યોરિટીની ટ્રેનિંગનું આયોજન કરવા જણાવ્યું હતું.

અંતમાં કમિટીના સભ્યોએ પ્રશ્નોત્તરી સેશનમાં વક્તાઓ પાસેથી વિવિધ પ્રશ્નો પર માર્ગદર્શન મેળવ્યું હતું. કમિટીનાં કો-ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌલ વ્યાસે આભારવિધિ કરી વેબિનાર સમાપ્ત કર્યો હતો.

Meeting with Zone 2 and 7 DCP Shri Vijay Patel & Shri Premsukhbhai Delu along with 27 Vepari Associations for Secure and Safe Business Practice - Dt. 11-11-2020



Webinar from Basics of Trade Marks, Copyrights, Patents and Design - Dt. 01-12-2020

તા. ૧-૧૨-૨૦૨૦ના રોજ GCCIની બિઝનેસ વિમેન વિંગ કમિટી તથા IPR એન્ડ લીગલ કમિટી દ્વારા બેઝિક ટ્રેડમાર્ક કોપીરાઈટ્સ, પેટન્ટ ડિઝાઈનની માહિતી આપતા વેબિનારનું આયોજન કરાયું હતું.

વેબિનારમાં બિઝનેસ વિમેન વિંગ કમિટીનાં ચેરપર્સન શ્રીમતી શિલ્પા ભટ્ટે સૌ સભ્યોને આવકાર્યા હતા તથા આ મહિલા સભ્યો

માટે યોજવામાં આવેલા આ વેબિનાર પોતાના ધંધા માટે કેવી રીતે સહાયરૂપ થઈ શકે તે જણાવ્યું હતું. બિઝનેસ વિમેન વિંગ કમિટીનાં કો-ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌર વ્યાસે ઉપસ્થિત વક્તાઓનો પરિચય આપ્યો હતો.

વેબિનારમાં વક્તા તરીકે ડૉ. રિશિત ભટ્ટ, એડ્વોકેટ ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. ટ્રેડમાર્કના વિવિધ



પ્રકાર, તેની એપ્લિકેશન પ્રોસેસ, અસરકારકતા વગેરે અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. શ્રી ઓમકાર આચાર્ય, એડ્વોકેટ MSMEને વર્તમાન સમયમાં પેટન્ટ ફાઈલ કરાવવી એ કેટલું અગત્યનું છે તે અંગે જણાવ્યું હતું. તેમણે સરકાર તરફથી પેટન્ટ ફાઈલ કરવાથી મળતા લાભ તથા વિમેન આંત્રપ્રિન્યોર તરીકે પણ ફાઈલ કરવાથી મળતા લાભો અંગે જણાવ્યું હતું. વેબિનારમાં શ્રી ગૌરવ સોની, એડ્વોકેટ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન અંગે માહિતી

આપતાં જણાવ્યું હતું કે ડિઝાઈન હંમેશાં નવી અને ઓરિજિનલ હોવી જોઈએ. પ્રશ્નોત્તરી સેશનમાં વક્તાઓ દ્વારા વિવિધ IPR સંબંધિત પ્રશ્નોના પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા.

વેબિનારના અંતમાં શ્રી જતીનભાઈ ત્રિવેદી, ચેરમેન, IPR એન્ડ લીગલ કમિટીએ આભારવિધિ સંપન્ન કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ બિઝનેસ, સર્જનાત્મક પ્રવૃત્તિમાં IPR ઘણો અગત્યનો ભાગ ભજવે છે.



Youthwing ICE Breaker Series - Dt. 02-12-2020



The 1st session for the Ice Breaker Series was held with a small group of 20 people to encourage member integration. The introduction was through a buddy system. We also had a group discussion on the case study of a small FMCG company trying to spread their wings from North India to Pan India and abroad.

Meeting with Mr. Mikko Potsonen, Counsellor (Economic & Commercial), Embassy of Finland, New Delhi - Dt. 02-12-2020

Shri P. M. Shah, Director, Industrial Safety & Health visited GCCI and had a cordial discussion on the issue of a circular regarding NOC to be obtained for Fire Safety.

He showed a positive attitude and gave us Elicable solution and assured us to process our request for time limit of one year to obtain NOC provided the unit undertakes to comply with the prevailing rules on the subject.

This will remove hurdles in obtaining new factory licensees as well as to renew the existing licences.



GCCI-Regional Council Meeting - Dt. 03-12-2020



તા: ૦૩-૧૨-૨૦૨૦ ના રોજ રિજનલ કાઉન્સિલની મિટિંગ મળી હતી, જેમાં શ્રી નટુભાઈ પટેલ-પ્રમુખ, GCCI, શ્રી હેમંત શાહ - સિનિયર ઉપપ્રમુખ, GCCI, શ્રી કે.આઈ. પટેલ-ઉપ પ્રમુખ, GCCI, શ્રી પથિક પટવારી - સેક્રેટરી, GCCI, શ્રી વી.પી. વૈષ્ણવ-



સેક્રેટરી (રિજનલ) GCCI & પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શ્રી સચિન પટેલ-ખજાનચી, GCCI, શ્રી એમ.ડી. પટેલ-પ્રમુખ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શ્રી શિવરામભાઈ પટેલ-બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ

ઈન્ડસ્ટ્રી, શ્રી આશિષ જોશી-સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી પ્રકાશ ગોરસિયા-સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી શૈલેશ શાહ-ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા-જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને શ્રી યોગેન્દ્રકુમાર ત્રિવેદી - સેક્રેટરી જનરલ GCCI ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી નટુભાઈ પટેલ, પ્રમુખ-GCCIએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા FIRE/NOCનો જે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેના માટે રિજનલ ચેમ્બર અને વિવિધ એસોસિયેશન સાથે તાત્કાલિક મિટિંગનું આયોજન કરાયું હતું અને પ્રશ્નો તૈયાર કરી સચિવશ્રી, શ્રમ અને રોજગાર વિભાગ સાથે મિટિંગ કરી આ પ્રશ્નો તેમને રજૂ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ ગંભીર કારણસર અમદાવાદના

ચીફ ફાયર ઓફિસર ઉપસ્થિત રહી શકે તેમ ન હતા, માટે મિટિંગ મુલતવી રાખવામાં આવી હતી અને નિયામકશ્રી, ઈન્ડસ્ટ્રીલ સેફ્ટી અને હેલ્થને તે દરેક મુદ્દા મોકલી આપવામાં આવ્યા હતા. વધુમાં, રિજનલ ચેમ્બરના ઉપસ્થિત સભ્યોએ તેમના વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી. આ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી હેમંત શાહ-સિનિયર ઉપપ્રમુખ, GCCIએ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બરની યુથ વિંગ અને બિઝનેસ વિમન વિંગ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે અને જો બીજી રિજનલ ચેમ્બરમાં પણ આવી કોઈ વિંગ સક્રિય હોય તો તેને GCCIની યુથ વિંગ અને વિમેન વિંગ સાથે જોડવી જોઈએ અને આ અંગે દરેક રિજનલ ચેમ્બર સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Webinar on Legal Tools for Speedy Recovery - Dt. 05-12-2020



IPR & Legal committee of Gujarat Chamber of Commerce & Industry has organized webinar on **Legal Talks Series for Industries. The subject of the first series was "Legal Tools for Speedy Money Recovery"** conducted on 05th December.

Shri Jatin Trivedi, Chairman, IPR & Legal committee highlighted the objective of this webinar series that it is focusing on regular and day-to-day issues faced by the industries. The sessions will resolve the problems faced by the industries and would guide on how the law can be used in one's favor.

Shri Pavan Godiawala, Advocate, IPR & Legal Committee member gave introduction about



speaker Shri Anshuman Mohapatra, Advocate & Managing Director of Vector Legal. In his address, Shri Anshuman explained on Civil Suit, Commercial Suit and Summary suit procedure. He explained the recovery of debt under MSME Act 2006, ADR, Type of Arbitration, Analogous proceedings, Legal proceedings, Contract management and various legal tools for recovery by presentation.

During the course of seminar several questions were raised & responded satisfactory.

The webinar concluded with a Vote of Thanks by Shri Pavan Godiawala, Advocate, IPR & Legal Committee member, GCCI.

Meeting with Mr. Mikko Potsonen, Counsellor (Economic & Commercial), Embassy of Finland, New Delhi - Dt. 08-12-2020



Minutes of meeting with Mr. Mikko Potsonen, Counsellor (Economic & Commercial) of Embassy of Finland, New Delhi.

DATE : 8TH DECEMBER, 2020.

Those who were present

Mr. Mikko Potsonen – Counsellor

Mr. Anil Jain – Chairman of Foreign Trade Task Force of GCCI for year 2020.

Mr. Yogendra Kumar Trivedi- SG. GCCI

Mr. Samir Mehta – EXIM Consultant

Mr. Jain welcomed Mr. Mikko and thanked him for his visit to GCCI.

Mr. Mikko expressed his gratitude to GCCI officials and said that he is planning to visit our state more frequently as they see a lot of opportunities which can be explored for mutual benefit of both the countries.

He also informed that they are in active dialogue with Govt of Gujarat and also Municipal authorities of the

state for mutual cooperation.

The key area of interest is increasing the trade and exploring investments at both ends.

The strength and priority for Finland would be Infrastructure and Energy and the scope in these 2 sectors are quite high and wide.

In addition to above he also expressed interest in ;

Construction material, Pharma, Chemicals & Used cooking oil.

He also shared that Finland is keen for immigration from Gujarat State and pan India as there are good opportunity for work & study in all different areas. He said they are looking for 1 million people as immigrant in time to come.

Mr. Jain expressed his happiness in all the information given by Mr. Mikko and he suggested that we - GCCI would be keen to organize a WEBINAR between member companies of State and Finland and it would be better if we can make it SECTOR specific such as;

For Construction Industries

For Pharma

For Chemicals etc.

Mr. Jain said that the priority can be suggested by Mr. Mikko and we can work out which is mutually beneficial to all.

Mr. Mikko will discuss with concerned people at his end and shall revert to us.

SG. Mr. Trivedi assured all the support and cooperation from GCCI.


Meeting with Shri P. M. Shah, Director, Industrial Safety & Health, GoG. - Dt. 09-12-2020



તા: ૦૯-૧૨-૨૦ ના રોજ ગુજરાત સરકાર ના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ના ડાયરેક્ટ શ્રી સી. એમ. શાહ સાથેની GCCI ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી કમિટીના ચેરમેન શ્રી અંબરભાઈ પટેલ અને અન્ય સભ્યોની મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

THEY ARE 18+ OFFER THEM THE LIFESTYLE!

Gen X Membership Starts @ ₹3 Lacs
(Age Group: 18-25 Years Only)



At The Edge Of The City Nestled In Greenery, Awaits A Plush Lifestyle In The Lap Of Luxury. With 9 Hole Par 36 Golf Courses And A Multitude Of Amenities For Your Indulgence And Leisure, **Gulmohar Greens** Is The Place To Be.

GULMOHAR GREENS - GOLF & COUNTRY CLUB LTD.

Gulmohar's Delight



Luxury Suites | Restaurants & Cafes | Swimming Pool | Gymnasium | Squash | Badminton | Billiards
Table Tennis | Snooker | Tennis | Miniplex | Gymboree - Kid's Park | Banquet Halls & Wedding
Lawns | Conference Room | Golf Course & Golf Academy | Adventure Golf | Pro-Shop

For Membership Contact

079 48983100/01/02/03/04

(Office Timing: 09:00 am to 05:30 pm - All Days except Sundays & Public Holidays)

Club - Next to "Gokul - Vrindavan", Off. Sarkhej - Sanand Highway, Village - Kolat, Taluka - Sanand, Ahmedabad

www.gulmohargreens.com | info@gulmohargreens.com | Follow us on  



ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની CSR ટાસ્ક ફોર્સ દ્વારા IMPACT4Nutritionના સહયોગથી “Exploring Multi–Sectoral Convergence for POSHAN ABHIYAAN” વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નીચે મુજબના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિષયવસ્તુ ઉપર ખૂબ જ સુંદર રીતે ચર્ચા પણ કરી હતી.

૧. શ્રી કે. આઈ. પટેલ, ઉપપ્રમુખ, GCCI
૨. શ્રી પીયૂષભાઈ દેસાઈ, ચેરમેન, વાઘબકરી ગ્રુપ
૩. શ્રી શુભરાજયોતિ ભૌમિક, Impact4Nutrition મેમ્બર
૪. શ્રીમતી અર્યના જોષી, ડાયરેક્ટર, દીપક ફાઉન્ડેશન
૫. શ્રી વસંત ગઢવી, ડાયરેક્ટર, અદાણી ફાઉન્ડેશન

આ વેબિનારનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને બિઝનેસના લીડર સમક્ષ “પોષણ”ના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો. હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની મહામારીએ આખા વિશ્વને સંપૂર્ણ પોષણની આવશ્યકતાઓ વિષે રૂબરૂ કરાવી દીધા છે છતાં પણ સામાન્ય જીવનમાં પણ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. એક જાગૃત નાગરિક તરીકે દરેકેદરેક માનવીની આ મૂળભૂત ફરજ છે કે તેઓ પોતાના ઘર-સંસાર, કામકાજની જગ્યાઓ અને આસ-પાસના એરિયામાં જ્યાં-જ્યાં કરી શકે તેમ હોય ત્યાં સંપૂર્ણ પોષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરતાં રહેવું જોઈએ.

વેબિનારની જ શરૂઆતમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી કે. આઈ. પટેલ દ્વારા સ્વાગત પ્રવચનમાં દરેક ઉપસ્થિત મહાનુભાવો અને બિઝનેસ લીડરનું આ વેબિનારમાં સ્વાગત કરાયું હતું અને એવી આશા

દાખવી હતી કે આ કાર્યક્રમના આઉટકમ સ્વરૂપે વધુમાં વધુ લોકો આ કામ અંગે જાગૃત થાય અને જોડાઈ શકે, જેથી કરીને મોટા પાયે માનવતાની ભલાઈનું કામ થઈ શકે.

આ કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કરતાં શ્રી પીયૂષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવેલ પોષણ અભિયાન વિષે જણાવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સામાન્ય રીતે બાળકો અને મહિલાઓમાં રહેતા કુપોષણ અંગેની જાગૃતતા લાવવાનો હતો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરતી દરેક વ્યક્તિને પોષણ મળવું એ આપણી વ્યક્તિગત-સામાજિક જવાબદારી (Individual Social Responsibility) ગણી શકાય તેવું મારું માનવું છે. આપણે આવા કાર્યક્રમોનો સરકારના બધા જ નીતિ નિયમોના પાલન સાથે દરેક રાજ્યમાં અને મોટા પાયે યોજવા જોઈએ.

Impact4Nutritionના શ્રી શુભરાજયોતિ ભૌમિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માર્ચ-૨૦૧૯માં માનનીય વડા પ્રધાન શ્રીના પોષણ અભિયાનને મજબૂતી આપવા આ પ્લેટફોર્મનું સંયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી લોકો સુધી પોષણયુક્ત ખોરાક લેવા અંગે જાગૃતતા લાવી શકાય અને બિઝનેસ લીડર્સ તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક કાર્યક્રમો અને લોક ઉત્થાનના કાર્યક્રમોમાં દરેકેદરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહેવું જોઈએ તે અંગે લોકોને સભાન કરી શકાય. આ ઉપરાંત તેઓએ ખાસ બધા કોર્પોરેટને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની કંપનીઓ દ્વારા ચાલતી CSRની કામગીરીમાં આ મુદ્દાનો સમાવેશ કરવા માટે અપીલ પણ કરી હતી.

દરેક ક્ષેત્રના અગ્રણીઓએ તેઓના કર્મચારીઓને પણ પોષણના મહત્વ અંગે માહિતગાર કરવા જોઈએ. હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ના લીધે દરેકેદરેક વ્યક્તિને રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે પ્રેરણા મળી છે, છતાં પણ પૂરતા પ્રમાણમાં પોષણ ના મળી રહેવાથી થતા નુકસાનને પહોંચી વળવા માટે તે અંગે ચોક્કસ માહિતી રાખવી એ દરેક નાગરિકની ફરજ ગણી શકાય. પોષણનું મહત્વ અને જાગૃતિ લાવવા માટેનું યુનિસેફ દ્વારા સ્થાપિત આ પ્લેટફોર્મ જે પ્રાઈવેટ સેક્ટરનાં મોટાં મોટાં કોર્પોરેટ્સ દ્વારા થતા



શ્રી શુભરાજ્યોતિ ભૌમિક,
Impact4Nutrition મેમ્બર

શ્રી વસંત ગઢવી, ડાયરેક્ટર,
અદાણી ફાઉન્ડેશન

શ્રી પીયૂષભાઈ દેસાઈ, ચેરમેન,
વાઘબકરી ગ્રુપ

CSRનાં કાર્યોમાં કેવી રીતે પોષણયુક્ત ખોરાકની મહત્વતા વધારવાના પ્રયાસો કરી શકાય અને તેઓ દ્વારા થતા CSRનાં હાથ ધરેલાં કાર્યો, અન્ય રિલીફ કાર્યો અને કામદારોના સર્વાંગી વિકાસ માટે કરેલાં કામો માટે પ્રેરક બને છે.

શ્રીમતી અર્યનાબહેન જોશી, ડાયરેક્ટર, ટીપક ફાઉન્ડેશન દ્વારા તેમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત દેશમાં વધુ પ્રમાણમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણની સમસ્યાઓ જોવા મળી રહે છે. આ માટે તેઓ દ્વારા સરકાર સાથે રહી ૬૭ જેટલી આંગણવાડીઓ સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવાનો અને તેના અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેઓએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપી હતી.

અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી વસંત ગઢવી દ્વારા પોષણના મહત્વ અંગે સમજણ પૂરી પાડવા માટે આંકડાકીય પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશન પોષણમાં રોકાણ અંગે ખૂબ જ મહત્વ આપે છે એવું જાણવા મળ્યું હતું. તેઓ દરેક વ્યક્તિને પૂરતું પોષણ મળી રહે તે માટે તેઓની આસપાસ Education,

Community Center, Sustainable Livelihood અને Community Infrastructure જેવી વિવિધ માળખાકીય સુવિધાઓ પર્યાપ્ત કરાવવા માટે કામગીરી કરી રહ્યા છે. તેઓ દ્વારા નર્મદા જિલ્લામાં ચલાવવામાં આવતી સ્નેહ શિબિર અંગે માહિતી પૂરી પડાઈ હતી, જેમાં તેઓ સુપોષણ સંગિનીઓ દ્વારા ત્યાંના લોકલ વિસ્તારમાં રહેતા લોકો સાથેની વ્યક્તિઓની મદદથી આ અંગે સમજણ પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંગિની પ્રોગ્રામ દ્વારા તેઓ બાળકો, તરુણ બાળકીઓ અને સગર્ભાઓના પોષણ અંગે ખૂબ જ કાળજી લઈ રહ્યા છે અને તેઓને પોતાના પરિવારમાં આ અંગે સમજાવી રહ્યા છે.

આ વેબિનારમાં ૭૨ જેટલી વ્યક્તિઓ Zoom Platformના માધ્યમથી જોડાઈ હતી. દરેક સ્પીકર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી સચોટ રીતે પોષણમાં રહેતી ખામીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે બહોળું માર્ગદર્શન પૂરું પાડે છે. નિષ્ણાતોએ પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા.

GCCI Youth Wing Industrial Visit to Coca-Cola Plant - Dt. 12-12-2020



The first Industrial visit by the GCCI Youth Wing for the year 2020-21 was organised on 12th December, 2020 to the Coca-Cola Plant in Sanand. The industrial visit was truly a unique experience as it is a state of the art, world class facility with complete digitisation and automation. The Indian Green Building Council (IGBC) has awarded the Gold certificate to this facility. The plant symbolises innovation and advancement in technology, excellence in management and empowerment through teamwork.

The members of the Youth Wing thoroughly enjoyed the plant visit and cherished the take-aways and learnings that enriched them. The plant implemented many impressive managerial and operational practices that were worth learning for the young entrepreneurs of GCCI Youth Wing. The plant focused on empowering, encouraging and motivating its employees from the top level management to the lowest level by educating them and creating a strong sense on team work and ownership. During the visit, the factory manager also shared some great practices that were followed at the plant for ensuring quality and efficiency in production.

The visit started off with a walkthrough around the plant and seeing the production and assembling process followed with an open round of discussion with the factory manager. After the visit, the members had a round of internal discussion to share their take-

aways and observations from this visit. The experience was truly a one-of-its-kind experience that were specially arranged for the members of the Youth Wing.

Some of the important take-aways from the visit were:


- Importance of collecting and analysing data in order to ensure optimum level of performance and avoid errors in operations.
- Creating and implementing SOPs to help an organisation operate smoothly and efficiently
- Importance of giving ownership to employees at a lower level in the hierarchy.
- Having a robust recruitment system to ensure that the right talent is recruited at all levels
- Importance of orientation and training during the recruitment process.

BWWWC Meeting with GCCI Office Bearers - Dt. 16-12-2020



ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિંગ કમિટીની વર્ષ ૨૦૨૦-૨૧ની નવનિયુક્ત થયેલ મહિલા સભ્યોની કમિટીએ તા. ૧૬-૧૨-૨૦૨૦ના રોજ ચેમ્બરના હોદ્દેદારો સાથે શુભેચ્છા મિટિંગ કરી હતી, જેમાં ઉપસ્થિત સભ્યોએ પોતાનો પરિચય આપ્યો હતો. મિટિંગમાં ચેમ્બરના હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કમિટી દ્વારા યોજનાર વિવિધ કાર્યક્રમોની માહિતી મેળવી હતી અને ચેમ્બર તરફથી તેમને પૂરો સહકાર મળી રહેશે એની ખાતરી આપી હતી.

Webinar on Foreign Inbound/Out Bond Investment - Dt. 16-12-2020



Webinar – Foreign Inbound/Out Bond Investment
A renowned CA Shri P. K. MODI an expert on International taxation conducted this 3 sessions webinar on major 3 topics;
Foreign Direct Investment (FDI)
Making and doing business outside India.
Compounding procedure for Contraventions under FEMA.
All 3 topics were deliberated in great detail and the audience was quite satisfied. The query from one of the overseas participants (From Hong Kong) was also duly responded.

Webinar with Principal Chief Commissioner of Income Tax, Shri Amit Jain on “Vivad Se Vishwas Scheme” - Dt. 18-12-2020



Gujarat Chamber of Commerce and Industry organized an Interactive session on Vivad Se Vishwas Scheme on 18th December, 2020. Shri Amit Jain, Principal Chief Commissioner of Income Tax, Gujarat was the Chief Guest for the session. Shri Amit Jain was accompanied by Shri Pradeep Mehrotra, Principal CIT-1, Shri Raj Tandon, Principal CIT (ReAC)-1, Shri Jaydeep Goel, Principal CIT-3, Shri Sandeep Jain, Principal CIT, Central, Shri Ajay Atri, CIT (TDS), Shri Mahesh Shah, CIT(International Taxation and Transfer Pricing, Shri Ritesh Parmar, CIT (Exemption), Shri Samir Tekriwal, CIT (Admin and Taxpayer Services), Ms. Jaya Chaudhary, Addl. CIT, Shri Sumit Balecha, Asst. CIT and Shri Umesh Pathak, Income Tax Officer.

Shri Natubhai Patel, President GCCI, in his address stated that before the scheme was launched, there were more than 4 lacs direct tax cases pending in various appellate forums i.e., Commissioner (Appeals), ITAT, High Court and Supreme Court. The idea behind the scheme is to reduce litigation in the direct tax arena and provide a fair chance to the

taxpayer to clear his dues without penalty and prosecution. He said that this scheme is similar to the Sab ka Vishwas Scheme launched by the Indirect Taxes department. He mentioned that originally, the scheme was extended from 31st March, 2020 to 30th June, 2020 and subsequently Government of India extended the date till 31st December, 2020. GCCI President suggested that the taxpayers should be allowed to pay the amount in 4-5 instalments, as the MSMEs are suffering badly due to liquidity crisis.

Shri Amit Jain, Principal Chief Commissioner, Income Tax, Gujarat in his keynote address mentioned about the objective behind introducing this scheme as well as the broad benefits of availing this scheme. He mentioned that he will recommend to the Board for allowing payment through instalments as requested by GCCI. With regards to GCCI's request, instead of a nodal officer, the Income Tax Department is creating a link where such queries could be submitted and they would be monitored thoroughly by the officers. He said that the link will become operational within a week.



Webinar on Christmas Workshop - Dt. 18-12-2020



તા. ૧૮-૧૨-૨૦૨૦ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની બિઝનેસ વિમેન વિંગ કમિટી તરફથી ક્રિસમસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામમાં કમિટીનાં ચેરપર્સન શ્રીમતી શિલ્પા ભટ્ટે ઉપસ્થિત સભ્યોને આવકાર્યા હતા. વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે શેફ ચેતના પટેલ, કૂકિંગ એક્સપર્ટ, સ્ટુડિયો ઇ 'ફૂડ કોર્ટ' અમદાવાદ તથા મિસ. આશ્કા પટેલ, ફાઉન્ડર, વેક્સ સ્ટુડિયો, અમદાવાદ હાજર રહ્યાં હતાં. શેફ ચેતના પટેલે સભ્યોને ક્રિસમસ માટે સ્પેશિયલ પ્લમ કેક અને કૂકીઝ બનાવતાં શિખવાડ્યું હતું અને મિસ આશ્કા પટેલે સભ્યોને ક્રિસમસ કેન્ડલ બનાવતાં શિખવાડ્યું હતું. આ વર્કશોપ સભ્યો માટે ખૂબ માહિતગાર રહ્યો હતો. અંતમાં ચેરપર્સન શ્રીમતી શિલ્પા ભટ્ટે આભાર માની પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

Webinar on Insolvency & Bankruptcy Code - Dt. 19-12-2020



IPR & Legal Committee of Gujarat Chamber of Commerce & Industry has organized webinar on **Legal Talks Series for Industries. The subject of the second series was "Insolvency and Bankruptcy Code, 2016 (IBC)" conducted on 19th December.**

Shri Jatin Trivedi, Chairman, IPR & Legal Committee highlighted the objective of this webinar series that it is focusing on regular and day-to-day issues faced by the industries. Shri Hemant Shah, Sr. Vice President, GCCI appricated IPR & Legal Committee to arrange such educative webinar for MSMEs.

Shri Jaideep Sharma, Advocate, IPR & Legal Committee member gave introduction about speaker Shri Pavan Godiawala, Advocate. He is practising in corporate laws since last 22 years. In his address, Shri Godiawala enlightened on various topic of IBC i.e., what is IC Code 2016, it's applicability, who can file petition, time period required to file, committee of



creditor (COC), resolution of applicant, how to contest petitions etc..

During the course of seminar several questions were raised & responded satisfactory.

The webinar concluded with a Vote of Thanks by Shri Jaideep Sharma, Advocate, IPR & Legal Committee member, GCCI.



Webinar on Roadmap to Recovery Post COVID Indian Economy - Dt. 23-12-2020



Gujarat Chamber of Commerce and Industry organized a webinar on Roadmap to Recovery Post COVID Indian Economy with Hon'ble Minister of Finance and

Corporate Affairs, Smt. Nirmala Sitharaman on 23rd December, 2020.

At the start of the program, Shri Natubhai Patel, President, GCCI, in his opening address highlighted a few suggestions for Direct Taxes, Indirect Taxes and Finance & Banking which included reduction in tax rates for non-corporate taxpayers on par with Corporate Taxpayers, allowing COVID care expenses and CSR under Section-37, making the benefit of presumptive Taxation under Section-44AD available to LLP, also difficulties faced in amendment of core fields with respect to GSTN, freezing the Income Tax Act for the entire tenure of the government for Ease of Doing Business, constitution of Tribunals under GST and difficulties faced by the borrowers due to RBI's circular regarding closure of current accounts of borrowers by non-lending banks. He also suggested higher fund allocation to manufacturing states like Gujarat in the forthcoming budget.

Shri Hemant Shah gave a brief introduction of Hon'ble Finance Minister and shared brief details about her



key role as the Defense Minister and Finance Minister.

Smt. Nirmala Sitharamanji in her address said that she considers the inputs received from Gujarat Chamber of Commerce and Industry very important and assured that the suggestions highlighted by GCCI will be appropriately addressed by the Ministry. In her address Hon'ble Finance Minister mentioned that the Government is committed to keep up the level of expenditure and promote infrastructure spending on key projects. Talking about the areas where Gujarat could capitalize on its strengths, she mentioned about the Solar Park at Kutchh, development of the GIFT City, the Alang Ship yard as well as Textiles and Diamond industry in Surat.

Hon'ble Finance Minister also talked about the objective and vision behind the Atmanirbhar Bharat scheme as well as the Production Linked Incentive scheme. In addition, she remarked that Artificial Intelligence and Innovation would be a key aspect for developmental growth.



Shri Pathik Patwari, Hon. Secretary, GCCI proposed the Vote of thanks for the event. In his concluding remarks he requested Hon'ble Minister to conduct one such session at every quarter. He also requested that a Post Budget Webinar be held with GCCI.

Youth Wing Kitchen Gardening Workshop - Dt. 19-12-2020



A Kitchen Gardening Workshop was hosted by Dr. Prachi Desai wife of Shri Parth Desai (Chairman-GCCI Youth Wing) at The terrace restaurant of Global adda , S. G. Highway, for the women and spousal members of GCCI Youth Wing. It was attended by 25 enthusiastic participants.

In today's times it has become necessary to learn how to grow one's own food and what is better than microgreens. They are highly nutritious and easy to grow.

The workshop was conducted by Girish Vagharia, a horticulturist. He talked about basics of Kitchen Gardening, different types of Soil, different media, amount of watering and sunlight, protection from

animals and insects, layering of seeds amongst other things. Participants also had a question answer session where problems faced routinely were solved. Everyone was given individual kits of seeds, pots and medium to do hands on and to take it home. It was followed by high tea and snacks.

Youth Wing Spousal member Mrs. Heli Shah (wife of committee member Jainam Shah) had sponsored Hand made beautiful colorful aprons from their Label Jagruti.

All in all it was a great time for the members to meet out in open after long and learn about kitchen Gardening.

Youthwing Connect Series - Dt. 26-12-2020



GCCI youth wing arranged Youth wing connect series with first generation entrepreneur Shri Niravbhai Patel, Founder and CEO Abaj Electronics Pvt. Ltd. on 26th December.

The event was organised at Abaj Techpark, Kadi, Mehsana. The event was attended by more than 45 youthwing members. Shri Niravbhai Patel and team Abaj welcomed youthwing members and they were given a tour of the LED tv manufacturing facility in simultaneous batches. It is the first factory in Gujarat which produces 6 Lacs LED TV annually. The company had a stone laying ceremony for the expansion of the plant where in capacity will be increased to 25 Lacs LED TV manufacturing recently. The members could see implementation of world class technology on TV. The factory has more than 50% female employees.

After the visit the Youth wing members were addressed by Youth wing Chairperson Shri Parth Desai. Shri Nirav Patels felicitation was done and he was welcomed to share his journey. He spoke on the



struggles of a first generation entrepreneur. He also said that the growth of a company happens together with the growth of all its stakeholders including employees, investors, suppliers, distributors.

He said to be a fast mover than a first mover. He showed the journey of television over 100 years. Also emphasised on scope of development in manufacturing in this field in India.

The event was followed by interaction and network with high tea. Over all the session was inspiring one for the members with a lot of take aways.

GCCI, અમદાવાદ સિટી પોલીસ અને લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ફુડ પેકેટ વિતરણ




ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, અમદાવાદ સિટી પોલીસ અને લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવની પ્રેરણા હેઠળ અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી મયંક સી. ચાવડાના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં કરફ્યુ દરમિયાન ભિક્ષુકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

GCCI અને અમદાવાદ સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે માસ્કનું વિતરણ



અમદાવાદ પોલીસ ઝોન-૨ તથા ૭ના DCP શ્રી વિજય પટેલ અને શ્રી પ્રેમસુખભાઈ ડેલુ તથા GCCCIના હોદ્દેદારોની એક મિટિંગ થઈ હતી અને અમદાવાદ ડે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ અમદાવાદના ગીચ અને ગરીબ વિસ્તાર જો માસ્કનું વિતરણ કરવામાં આવે તો કોરોના ફેલાતો રોકવામાં ઘણી મદદ થઈ શકે. આ વિનંતીને ધ્યાનમાં લઈ ૧,૪૦,૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Webinar with Hon'ble Union Minister of State Shri Mansukhbhai Mandaviya on Expansion of Production Linked Incentive (PLI) Scheme - Dt. 30-12-2020



ઉદ્યોગ અને ઈજનેરી ઉદ્યોગો માટે પણ લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. વધુમાં તેમને ગુજરાત ચેમ્બરને મહત્વની કમિટીઓમાં સ્થાન આપવા તેમજ નવા ઉદ્યોગો સ્થાપવા માટે અને હાલમાં કાર્યરત ઉદ્યોગોના વિસ્તરણ માટેની મંજૂરીઓ ચોક્કસ સમયગાળાની અંદર આપી દેવા માટે સૂચન કર્યું હતું. પોર્ટ પર માલના નિકાસ માટે પૂરતા પ્રમાણમાં શિપિંગ કન્ટેનર ન હોવા અંગે પણ તેમણે ધ્યાન દોર્યું હતું.

તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના પોર્ટ, શિપિંગ, વોટરવેજ (સ્વતંત્ર ભાર) તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર્સ વિભાગના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે “પ્રોડક્શન લિંકડ ઈન્સેન્ટિવ સ્કીમ ઈન અધર કેટેગરીઝ” પર એક ઈન્ટરેક્ટિવ વેબિનાર યોજાયો હતો.

પ્રમુખ શ્રી નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંકડ ઈન્સેન્ટિવ સ્કીમ જે ફામસ્યુટિકલ ઉદ્યોગોને લાગુ પડે છે તે ખરેખર પ્રશંસનીય છે અને ઈજ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે આ જ યોજના અન્ય ક્ષેત્રો જેવાં કે કેમિકલ ઉદ્યોગો, પ્લાસ્ટિક

શ્રી મનસુખભાઈ માંડવિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંકડ ઈન્સેન્ટિવ સ્કીમ અન્ય સેક્ટર જેવાં કે ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ, ઓટોમોબાઈલ, ફાર્મા, કેમિકલ, ફૂડ પ્રોડક્ટ્સ એન્ડ પ્રોસેસિંગ પર પણ લાગુ કરવાની યોજના ચાલી રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધુમાં ઈન્ડસ્ટ્રીઝમાં સેલ્ફ સર્ટિફિકેશનને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયત્નશીલ છે. અન્ય મુદ્દા અંગે તેમણે વિગતવાર રજૂઆત કરવાનું કહ્યું હતું.





PASHUPATI GROUP
GROWTH WITH VISION

A platform where innovation, dedication,
& optimism converge into **SUCCESS...**




TEXTILE

PASHUPATI
FARM TO FASHION

SPINNING TOGETHER TO SUCCESS

- Ginning • Oil Mill • Delinting • Spinning • TFO • Weaving
- Warehouse (3.5 lac sq.ft.) • Solar Roof Top (2.7MW)



PHARMACEUTICAL

uniza™ HEALTHCARE LLP -Marketing Division
• Dermatology • Respiratory
• Anti infective • Gastroenterology

uniza™ LIFECARE PRIVATE LIMITED-Manufacturing Division
• WHO-GMP certified
• Tablets • Capsules • Topical preparations.



HOSPITALITY

श्री Hotel
WELCOME

WHERE "UNIQUE HOSPITALITY" is our motto.


- ROOMS • RESTAURANT
- CONFERENCE • BANQUET (UPTO 1000 Guest Capacity)





UNION BUDGET 2021

At a Glance



Contributed by



Shri Jainik Vakil
Chairman
Direct Tax Committee



Shri Yash Shah
Member
Direct Tax Committee

#BEINAM♥MENT™



THE POWER OF STEEL

Maxim

TUBES COMPANY PVT. LTD.

www.maximtubes.com

STAINLESS STEEL SEAMLESS & WELDED PIPES | TUBES | U TUBES

Ensuring **Stainless Performance**™

TABLE OF CONTENTS

CHAPTER 1: RATES OF INCOME TAX: (For FY 2021-22)	26
CHAPTER 2: KEY AMENDMENTS IN REGARDS TO REAL ESTATE SECTOR	31
CHAPTER 3: CORPORATE RESTRUCTURING	33
CHAPTER 4: CHANGES IN THE WAY WE DEAL WITH INCOME TAX OFFICERS FOR ASSESSMENTS	38
CHAPTER 5: TAX PROVISIONS PERTAINING TO TDS & TCS.	41
CHAPTER 6: ANTI ABUSIVE TAX MEASURES.	42
CHAPTER 7: CERTAIN MEASURES TO INCENTIVIZE THE TAX PAYERS . . .	46
CHAPTER 8: INTERNATIONAL TAX PROVISIONS.	48
CHAPTER 9: GST (INDIRECT TAXES)	50

Chapter 1: Rates of Income Tax: (For FY 2021-22)

I. Individual & HUF -

- Taxpayer: Individual (Resident aged less than 60 or HUF) - No change in rates as compared to F.Y. 2020-21.

Option - 1	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than 10,00,000	30%

Option 2 - Tax Rates u/s 115BAC (Introduced in Finance Act, 2020) – refer point “i” below	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 7,50,000	10%
INR 7,50,001 - INR 10,00,000	15%
INR 10,00,001 - INR 12,50,000	20%
INR 12,50,001 - INR 15,00,000	25%
More than 15,00,000	30%

- Taxpayer: Individual (Resident Senior Citizen (>=60 Years))

Option - 1	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than 10,00,000	30%

Option 2 - Tax Rates u/s 115BAC (Introduced in Finance Act, 2020) – refer point “i” below	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 7,50,000	10%
INR 7,50,001 - INR 10,00,000	15%
INR 10,00,001 - INR 12,50,000	20%
INR 12,50,001 - INR 15,00,000	25%
More than 15,00,000	30%

- Taxpayer: Individual (Resident Super Senior Citizen (>80 Years))

Option - 1	
Total Income	Tax Rates
Up to INR 5,00,000	Nil
INR 5,00,001 - INR 10,00,000	20%
More than 10,00,000	30%

Option 2 - Tax Rates u/s 115BAC (Introduced in Finance Act, 2020) – refer point “i” below	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 7,50,000	10%
INR 7,50,001 - INR 10,00,000	15%
INR 10,00,001 - INR 12,50,000	20%
INR 12,50,001 - INR 15,00,000	25%
More than 15,00,000	30%

Points to be noted:

i. Taxpayer may opt for new scheme i.e. reduced tax rate only if not availing certain exemptions/deductions. Illustrative list of such exemptions/deductions that the taxpayer cannot consider if opting for new tax regime is as below:



- Standard Deductions of INR 50,000.
- Exemption towards House Rent Allowance (HRA) and Leave travel Concession (LTC)
- Additional Depreciation
- Deduction towards House Rent Allowance (HRA)
- Interest in respect of housing loans for self-occupied property
- Donation or expenditure for scientific research
- Deductions in respect of -
 - Various Investments such as PPF, LIC, etc. under section 80C
 - Medical Insurance premium or Amounts paid towards family pension
 - Donations under section 80G
 - Interest on savings deposits or post office deposits etc.
- However, Deduction of Employer's Contribution towards National Pension Scheme (NPS) and deduction of additional salary to additional employee under section 80JJAA would be still available
- Further AMT is not applicable if opted for New Scheme and AMT credit available will lapse.

ii. For Individuals whose Income is less than INR 5,00,000, Rebate from tax is available at INR 12,500 or 100% of tax whichever is lower

II. Association of persons, Body of Individuals and Artificial Juridical Person:

Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than 10,00,000	30%

- Alternative minimum tax rate is 18.5%.

In case of Individuals, HUF, AOP, BOI, Surcharge is applicable at following rates:

Total Income	Tax Rates
INR 5,000,000 to INR 10,000,000	10%
INR 10,000,001 to INR 20,000,000	15%
INR 20,000,001 - INR 50,000,000	25%
More than 50,000,000	37%

III. Firms (including LLP):

Firms (including LLPs) are taxable at 30%. Surcharge at 12% is applicable where total income exceeds INR 10,000,000. Health and Education Cess is at 4%.

IV. Domestic Companies:

Domestic Manufacturing Companies set up on or after 01/10/2019 and commencing manufacturing on or before 31/03/2023	
Engaged solely in business of manufacture, production, research or distribution of article or thing	
Tax Rate with respect to income from business of manufacture, production, research or distribution of article or thing	
Tax Rate (Without Specified benefits or deductions [#])	15%
MAT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%
Income which is not incidental to manufacturing or production of an article or thing, for which no specific rate is provided in this section & from short term capital gains on sale of assets on which no depreciation is allowable under the provisions of the Act	
Tax Rate (Without Specified benefits or deductions [#])	22%
Surcharge	10%
Health and Education Cess	4%
Income from the business transactions arranged in a manner or for some other reason, the profits earned by the company is more than the ordinary profit earned in such business, any such more profit as determined by the income tax officer	
Tax Rate (Without Specified benefits or deductions [#])	30%
Surcharge	10%
Health and Education Cess	4%
Existing Domestic Manufacturing Companies incorporated prior to 1/10/2019 and not opting for concessional rate of Tax and Turnover not exceeding INR 400 Crores in previous year 2019-20	
Engaged solely in business of manufacture, production of article or thing	
Tax Rate	25%
MAT	15%
Surcharge:	
More than INR 10,000,000 but less than INR 100,000,000	7%
Exceeds INR 100,000,000	12%
Health and Education Cess	4%

Existing Domestic Companies incorporated prior to 1/10/2019 and opting for concessional rate of tax	
Engaged solely in business of manufacture, production of article or thing	
Tax Rate (Without Specified benefits or deductions#)	22%
MAT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%

Other Domestic Companies with turnover exceeding INR 400 Crores in (Previous Year 2019-20)	
Tax Rate	30%
MAT	15%
Surcharge:	
More than INR 10,000,000 but less than INR 100,000,000	7%
Exceeds INR 100,000,000	12%
Health and Education Cess	4%

Prescribed benefits and deductions:

- Deduction available for units established in special economic zones
- Additional Depreciation and Investment Allowance
- Various deduction for donation or expenditure for scientific research
- Deduction for capital expenditure for specified business u/s 35AD
- Deductions in respect of tax holidays as specified under the Act.
- Any brought forward losses if such losses were incurred in respect of above mentioned deductions.

Furthermore, if a company opts to pay taxes at concessional rates, it shall not be taxed under the Minimum Alternate Taxes (MAT) regime and accordingly, will have to forgo all the unutilized MAT Credit.

V. Foreign Companies:

Foreign Companies	
Tax Rate	40%
MAT	15%
Surcharge:	
More than INR 10,000,000 but less than INR 100,000,000	2%
Exceeds INR 100,000,000	5%
Health and Education Cess	4%

VI. Co-operative Societies:

Taxable Income	
Up to INR 10,000	10%
INR 10,000 to 20,000	20%
Above 20,000	30%

Silver Femmes



*Exquisite collection of handcrafted Silver
Jewellery, Utensils, Articles
and much more. . .*

☎ +91-7069 651 651

✉ info@silverfemmes.com

🌐 www.silverfemmes.com

📍 7-8 GF, Kamal Complex, Nr. Stadium Circle, C.G. Road, Navrangpura, Ahmedabad 380009

Co-operative Societies resident in India:

Co-operative Societies	
Tax Rate (Without Specified benefits or deductions)	22%(u/s 115BAD)
AMT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%

Co-operative Societies other than above:

Co-operative Societies	
Tax Rate	30%
AMT	18.5%
Surcharge where total Income exceeds INR 10,000,000	12%
Health and Education Cess	4%

Chapter 2: Key Amendments In Regards To Real Estate Sector

- **Extending Incentives of 100% tax deduction for Real Estate Developers in the business of Affordable Housing Segment.**

As per the existing Income Tax Provisions, developers in the business of constructing *affordable housing segment* enjoy a tax holiday to the extent of 100% of their profits earned from such project.

The above deduction of 100% profits was available only if the real estate developer got the housing project approved from the competent authority on or before 31.03.2021. This budget now extends this benefit for one more year.

Thus, affordable housing projects approved during the period 01.04.2021 to 31.03.2022 will also be eligible for deduction of 100% profits subject to the fulfillment of the other conditions notified by the government.

Further, this budget also, expands the scope of benefit under which deduction of 100% profits can be claimed. A rental housing project i.e. *developing and constructing a rental housing project would also be eligible for claiming 100% tax deduction* subject to fulfilment of other conditions attached with a notified rental housing project.

This amendment will be effective from 01.04.2021

- **Allowing Interest deduction of INR 1,50,000 to first time home buyers until 31.03.2022**

Under the existing provisions, a deduction of INR 1,50,000 can be claimed by a tax payer in respect of interest paid on loans taken from a financial institution subject to the following conditions:

- A) Loan has been sanctioned during the period beginning on or before 31-03-2021.
- B) The stamp duty value (jantri value or circle rate) does not exceed INR. 45,00,000
- C) The tax payer does not own any other residential house property on the date of sanction of loan.

Now, in order to help such first-time home buyers, it is proposed to extend this benefit for one more year i.e. until 31.03.2022. Hence, all the first time home buyers, if satisfying the above conditions, can claim an additional tax deduction of INR 1,50,000 towards interest paid on such housing loans.

This amendment will be effective from 01.04.2021

- **Permitting home buyers/ real estate developers to transact in residential units with a margin of 20% difference in value to the existing stamp value.**

Under the existing tax laws, the seller is required to effect / conclude sale of land / building at least at a stamp value (i.e. Jantri Value). Any transaction disclosed at a sale price lesser than the stamp duty shall be substituted with the stamp value.

Similarly, for the same transaction (sale of land / building) which has happened at a price lesser than the stamp value, in that case the buyer is taxed at the difference between the transaction price and the stamp value (provided difference is more than INR 50,000).

Thus, for all regulatory reasons, transactions comprising of sale of Land & Building would have to be concluded at a minimum of stamp duty value. However, situation would arise where the fair market value of such land and building would be lesser than the stamp value and hence it would create unnecessary hardship to the taxpayer. Hence, in order to ease the burden on concluding the transaction, the Government provided safe harbour limit of 10% i.e. where the stamp value was within 110% of the actual transaction value, the Income tax department would accept the actual transaction price irrespective of it being lower than stamp value.

Now this budget increases the safe harbour limit from 10% to 20%. Thus, where the stamp value is within 120% of the actual transaction value actual consideration, the transaction would be accepted by the Tax officers as a compliance of the existing tax regulations. This amendment is subject to following conditions.

- a. The transfer of residential unit takes place during the period from 12th November, 2020 to 30th June, 2021
- b. The transfer is by way of first time allotment of the residential unit to a person
- c. The consideration received or accruing as a result of such transfer does not exceed INR 2 crore.

This amendment will be effective from 01.04.2020

- **Incentives for units to locate in International Financial Services Center (GIFT CITY)**



The Government is committed to making the International Financial Services Centre (IFSC) in GIFT CITY a global financial Hub. And this budget certainly did bring this aspect out abundantly. In addition to the tax incentives already provided, the Finance Bill, 2021 proposes to include the following

1. Tax holiday in respect of capital gains income for aircraft leasing companies

2. Tax exemption for aircraft lease rentals paid to foreign lessors;

With a view to promoting India as an aircraft MRO hub and attracting foreign investment into India it has now been proposed that any income of a non-resident by way of royalty on account of aircraft lease which is paid by a unit in IFSC will be tax exempt. Similarly, the IFSC unit will also enjoy 100% tax deduction from income on transfer of the aircraft/ aircraft engine (provided such asset was earlier leased to a domestic company which is in the operations of aircrafts). This measures a fillip to the nascent aircraft industry in India and also encourages to set up shops in IFSC.

3. Tax incentive for relocating foreign funds to the IFSC (Gift City): Under the existing provisions resident as well as non-resident investor of AIF are taxable on any income received other than income from business. It is now being proposed

- A) To exempt capital gains in the hands of non-resident investors on transfer of shares of a Company

resident in India by the resultant fund subject to certain conditions.

- B) Any transfer in regards to relocation from offshore fund to resultant fund shall not be a transfer liable to tax
- C) Similarly, any transfer by a non-resident shareholder of shares/units held in offshore funds in consideration for shares/units of resultant fund shall not be a transfer liable to tax

4. Tax exemption to the investment division of foreign banks located in IFSC.

Any income arising to a non-resident on sale of “non deliverable forward contracts” entered into with an offshore banking unit in IFSC shall be exempt.

This amendment will be effective from 01.04.2021

Chapter 3: Corporate Restructuring

• Facilitating strategic disinvestment of public sector companies

The Honorable FM has kept an ambitious target in regards to completion of strategic disinvestment of various Public Sector Companies (PSCs) such as BPCL, Air India, Shipping Corporation of India, Container Corporation of India, IDBI Bank, BEML and Pawan Hans in FY 2021-22. In order to facilitate strategic disinvestment of PSCs in a tax efficient manner, the following provisions have been relaxed: -

The definition of demerger under the Income Tax Act has been widened so as to treat reconstruction or splitting up of a PSC into separate companies as tax neutral demerger (subject to fulfilment of other conditions)

Until now, benefit of carry forward and set off of losses pursuant to amalgamation of a PSC was allowed only if both the companies proposed to be amalgamated were engaged in the of business of operation of aircraft. Now this benefit will be extended to all PSCs (Any business operation) (subject to satisfaction of other conditions)

Further, the allowability of carry forward of losses/unabsorbed depreciation has been capped to the extent of losses prevailing as on the date on which the PSE ceases to be a public sector company pursuant to the strategic disinvestment.

This Amendment will be applicable from 01.04.2020

• Advance tax instalments for dividend income

Presently, a taxpayer is required to pay advance tax on his entire estimated income for the full year in 4 instalments. Thus, a lot of estimation is involved while computing the amounts of advance tax. Any default/delay in payment of advance tax instalments, interest at the rate of 1% per month is levied.

Now, in order to address this issue of taxpayer being charged interest, for incorrect estimation of advance tax, relaxation from levy of interest is provided in respect of following types of income provided full tax is paid in subsequent advance tax instalments.

a) Capital Gains

b) income from winnings of lotteries, crossword puzzles, races, card games, gambling or betting of any form or nature



c) Any business income which has accrued for the first time

d) Dividend income (excluding deemed dividend) received by certain taxpayers in excess of INR 10 Lakhs. (Newly Inserted)

This Amendment will be applicable from 01.04.2020

- **Extending the meaning of Slump sale to cover slump exchange as well.**

Slump sale means sale of any undertaking (division) where values are not assigned to individual assets and liabilities of the undertaking but a consolidated value is assigned to the whole undertaking. Slump sale would give rise to capital gains tax in the hands of the taxpayer.

Income Tax Act contains special provisions for computation of “capital gains” in case of slump sale. For this purpose, Slump sale has been defined to have the following attributes: -

There should be one or more undertaking (Undertaking means a unit or division constituting a business activity)

- Such undertaking/s should have been transferred during the year
- Transfer of such undertaking/s should have been **“as a result of sale”**
- Consideration for transfer of undertaking should have been determined on lump sum basis i.e. without values being assigned to individual assets and liabilities

The term ‘as a result of sale’ in the definition of Slump Sale has been interpreted by some taxpayers and courts to exclude certain modes of sale/transfer such as “exchange, extinguishment, relinquishment etc” referred in the definition of “transfer” under the Income Tax Act.

Accordingly, A lot of tax payer used the mode of “Slump Exchange” (not defined in the Income Tax Act but referred in judicial precedents) as a part of tax planning / optimization which involved an exchange of an undertaking by a seller for non- monetary consideration (like shares, debentures etc) of the buyer and the same had been held by tax courts as not liable to tax since such a transaction was not a part of “Slump Sale” as defined in the Income Tax Act.

Budget 2021, brings such above transactions such as “Slump exchange” within the ambit of taxable Slump Sale transaction.

This provision is applicable with effect from 01.04.2020.

- **Taxation on payment of excess amounts to a partner on Dissolution / Reconstitution of a Firm / AOP / BOI**

A person who receives any asset (other than monies) at the time of dissolution or reconstitution of the firm/AOP/BOI in excess of the balance in the capital account of the partner in the books of account of firm/AOP/BOI, then such excess is not chargeable to tax in the hands of retiring partner, being a transaction out of the purview of the provisions of the Capital Gains Tax in terms of the current provisions of the Indian Income Tax Act.

In order to bring abovementioned transactions within the purview of Income Tax Act, amendments have been made in the Income Tax Act so as to treat any amount received on dissolution or reconstitution of the firm/AOP/BOI in excess of amount standing to the credit of person in the books of accounts shall now be taxed in the hands of Firm / AOP /BOI as capital gains (Even though it is the partner who takes away more money than what is credited to his account)

This provision is applicable with effect from 01.04.2021.

- **Taxability on transfer of capital asset to partner on dissolution or reconstitution**

The existing provisions of the Income Tax Act provides that any profits or gains arising from the transfer of a

“capital asset” shall be chargeable to tax in the hands of the taxpayer.

This also covers the profits arising from the transfer of a capital asset by way of distribution of capital assets to the members/partners on the dissolution of a Firm/AOP/BOI. The fair market value of the asset on the date of such transfer shall be deemed to be the full value of the consideration for this purpose.

However, a view was being taken by certain courts that since Firms/BOI/AOP are not separate legal entities, such distribution of capital assets in case of dissolution / reconstitution would be outside the purview of transfer and consequentially not subjected to tax (principle of duality)

In order to bring abovementioned transactions within the purview of Income Tax Act, amendments have been made in the Income Tax Act so as to treat capital asset received on dissolution or reconstitution of the firm/AOP/BOI representing their capital shall deemed to be the income (capital gains) in the hands of the Firm/AOP/BOI

This Amendment will be applicable from 01.04.2021

- **Dividend in the Hands of Foreign Company not subjected to MAT**

In case of Foreign Companies, the present income tax provision for computing “Book Profits” for MAT liability state that income from certain sources such as “capital gains”, “interest”, “Fees for technical services” and “royalty” shall not be considered as a part of income for computing book profits liable to MAT if such income are credited to the profit & loss account and the rate of tax prescribed under the tax treaty (DTAA) is lesser than the rate of tax prescribed for MAT. Thus essentially, if a beneficial rate is provided for certain sources of income for a foreign Company under the DTAA then the same should be applied rather than the rate given for taxing “book profits” under MAT.

Now, since dividend is also taxable in the hands of foreign company being a shareholder (Dividend is now taxed in the hands of the shareholders since DDT is exempted), Budget 2021 has considered dividend also on the same footings as other sources of income for the foreign shareholder. Thus dividend should also be excluded for the calculation of book profit of a foreign company in case the tax payable on such dividend income is less than MAT liability on account of concessional tax rate provided in a relevant tax treaty.

This amendment is effective from 01.04.2020

- **Exemption from TDS in case of dividend paid to business trust**

In the previous budget dividend income was made taxable in the hands of recipients of such Dividends. Consequentially, TDS was also made applicable while making payments of such dividends.

Due to the above amendment TDS was even made applicable on dividend payable to a business trust i.e. Infrastructure Investment Trust (InvIT) and Real Estate Investment Trust (REIT). However, this was never the intention as Business trust’s enjoy a “pass through status” in respect of income earned by it. In other words, any income earned by the business trust is directly taxable in the hands of the unit holders of the business trust (being a pass-through entity, popularly called tax transparent entity). Hence, subjecting payment of dividends to TDS was not the objective of the law.

Accordingly, to set right these unintended consequences of the amendment made last year, Budget 2021 has now provided that the TDS (with-holding tax) provisions shall not apply to dividend income paid to a business trust

This amendment will take effect from 1st April, 2020.

- **Income already offered for tax of past years on account of TP Adjustment not to form part of book profits in succeeding years for computing MAT**

Presently, depending on the tax regime selected by a Company, it is required to pay higher of the tax under



AWARDS

JAIPUR JEWELLERY SHOW

BEST JADAU JEWELLERY MANUFACTURER

GEM & JEWELLERY TRACE COUNCIL OF INDIA

ANANT DIAMOND JEWELLERY REGIONAL PRIZE

BEST GOLD JEWELLERY OF THE NATIONAL JEWELLERY AWARDS

BEST GROWING COMPANY OF THE YEAR PRECIOUS METAL JEWELLERY - PLAIN & STUDED

PRECIOUS METAL JEWELLERY - PLAIN & STUDED (SME) RUNNER UP

EXCELLENCE IN PRECIOUS METAL JEWELLERY STUDED (SMALL)

IJ AWARDS BEST GOLD JEWELLERY OVER RS.2,50,000

JEWELLERY MANUFACTURER OF THE YEAR

Gold - Diamond - Polki



Laxmi Jewellery House, Nr. Samatheshwar Mahadev Mandir,
Swagat Cross Road, Ellisbridge Ahmedabad - 380006

Crafting
Masterpieces



The beauty of our heritage exclusively crafted in gold

079-26447540,26445515 contact@laxmijewellery.com

normal provisions of the Income Tax Act (Tax Profits) or Minimum Alternate Tax regime (Book Profits).

The current provisions of MAT do not provide for adjustment (reduction) of book profit for any additional income of past year(s) included in books of account of current year on account of secondary adjustment made under the Transfer Pricing regulations or on account of Advance Pricing Agreement (APA) entered by the taxpayer with the Tax Office. Since such income has already suffered tax under normal provisions of income tax (tax profits) in the earlier years the same cannot be subjected to tax again in the current year just because it has been accounted for in the books on account of Transfer Pricing Adjustment.

Accordingly, it is proposed that when past year(s) income (on account of TP adjustment) is included in current years' book profit the Tax officer shall recompute the book profit and tax payable on the same and give consequential relief to the taxpayer.

This amendment will take effect from 1st April, 2020.

- **Disallowing Tax Depreciation on Goodwill**

In most of the M&A transactions where the acquirer company that has acquired a business either by way of acquisition of shares, slump sale (purchasing a business undertaking) or a merger, would normally pay fair value to the seller which constitutes value of Tangible assets such as fair values of Land Building etc plus the Goodwill and other intangibles. Thus, the price paid over and above the book value of the sellers company / business was towards goodwill and other intangibles.

Thereafter, the acquirer would claim depreciation on the total assets (Tangible + goodwill + Intangibles if any) so acquired. Thus such goodwill would be eligible for depreciation in the hands of the buyer, thus reducing the acquirers tax liability..

A big change has been incorporated vide the budget 2021, that will impact Merger and Acquisition Transactions in India. It is now being proposed to amend various provisions of the Income tax act which would potentially disallow the claim of depreciation on Goodwill. This amendments seeks to overrule multiple court judgments which stated that goodwill was a depreciable asset for tax purposes.

Every acquirer of business always factors in the tax shield /benefit available to him while purchasing a business. Seldom do deals happen at book values. Therefore just at the buyer is entitled to depreciation on tangible assets, he would expect depreciation claim on intangible assets such as goodwill as well.

However, this budget clearly informs in detail that many taxpayers were taking undue advantage of claiming depreciation on goodwill. Taxpayers would enter into internal M&A's and thereby create goodwill where the buyer would end up having tax advantage on goodwill depreciation whereas the seller would not be charged any tax on account of merger being tax free. Thus, in order to curb this practice the government has come out with this amendment which unfortunately would deprive acquirers from claiming depreciation on goodwill arising from third party business purchases as well

This amendment will be applicable from 01.04.2020

Chapter 4. Changes In The Way We Deal With Income Tax Officers For Assessments

- **A newly introduced Dispute Resolution Committee for Small and Medium Taxpayers.**

In order to provide tax certainty to small and medium tax payers, it has been proposed to set up a Dispute Resolution Committee (DRC) wherein tax disputes for small and medium tax payers would be resolved at a very initial and early stage. The DRC has authorized to reduce or waive off penalty and grant immunity from prosecution. It has also proposed that such DRC will be functional through faceless mechanism and have a dynamic jurisdiction.

Eligible taxpayers to opt for the scheme:

- (i) Taxpayer has filed return of income of less than INR 50 lacs
- (ii) The adjustment provided in the income tax order is less than INR 10 lacs.
- (iii) The said order should not be as a result of search, survey, raid or information exchange from a foreign counterpart country.
- (iv) The taxpayer shall not have any been detained, convicted or prosecuted under any provisions of Income Tax, Benami Transactions Act, Foreign Exchange, Prevention of Smuggling, Money Laundering etc

A tax payer will be eligible to approach the DRC for orders passed after 01.04.2021

- **Now Faceless proceedings even before Income-tax Appellate Tribunal**

In order to impart better efficiency, transparency and accountability for the taxpayer, faceless assessments, faceless appeals and faceless penalty schemes were introduced. By this, the interface between the taxpayer and tax department was intended to be reduced/eliminated.

On similar lines this budget 2021 is proposing to even introduce faceless appeals at the Income Tax Appellate Tribunal (ITAT) thereby eliminating interface between the ITAT and the parties to the appeal.

It may be noted that Tribunal is the last factfinding authority. Appeals beyond this stage are admitted in the High Court only if there is a substantial question of law. Both the parties i.e., the taxpayer as well as the Income Tax Department are given proper opportunity of being heard only at the ITAT level. The taxpayer tried to demonstrate and defend its case in complete detail by filing voluminous papers and awarding any judgment by the ITAT judge requires proper examination of the facts. Further, It is also an established fact that lack of opportunity of being heard, results into violation of the principles of natural justice. Recently a Writ Petition challenging the faceless appeal scheme has been filed before the Hon. Delhi High Court that lack of opportunity of being heard will lead to violation of principles of natural justice, the outcome of which is being awaited.

This amendment will take effect from 1st April 2021

- **Discontinuance of Income Tax Settlement Commission (ITSC)**

Income-tax Settlement Commission is a quasi-judicial body set up under the Income-tax Act with the main objective of settling complicated cases and avoiding prolonged litigations. A tax payer was able to approach the Settlement Commission during the pendency of the assessment proceedings subject to certain other conditions.

However, this budget proposed that w.e.f 01.02.2021 ITSC would be discontinued. Accordingly, no new application would be permitted to be referred to ITSC. Following are the points to be noted.

1. For all pending matters that are eligible before ITSC, the same would be referred and heard by a new Interim Board that will be constituted
2. Further, in order to impart greater transparency and accountability by the Interim Board, the scheme is also envisaged to be faceless
3. Taxpayer may withdraw such application on or before 30.06.2021 by putting in application to the



Tax Officer. If the existing application is not withdrawn within the permissible time limit, then it shall be deemed to have been referred to the Interim Board

- **Refund of excess amounts paid towards declaration under the Income Declaration Scheme, 2016 (IDS):**

Income declaration Scheme, 2016 had specifically provided that taxes/ surcharge or penalty paid under the IDS scheme was not refundable. However, this resulted into genuine hardship for taxpayers who had paid a higher amount than their respective dues resulting into amounts receivable from tax departments.

This issue was addressed by making amendments with retrospective effect by permitting the refund of such excess amounts paid than due/required under the IDS scheme. However, this budget has further clarified that interest on such refunds will not be given.

This amendment will take effect retrospectively from 1st June, 2016.

- **Reduction in Time limit to file Belated Or Revised Returns Of Income And Regular Assessment Procedure**

With the massive technological upgrade in the Income Tax Department introducing faceless and jurisdiction-less appeals, the time taken to process the return of income and for completion of the assessment/scrutiny have greatly reduced. Therefore, Budget 2021 seeks to amend the time limit to file revised and belated returns of income.

Sr. No	Section Amended	Existing Provision	Amendment made by Finance Bill, 2021
1	Filing of Regular Return of Income for partners of a firm to whom transfer pricing provisions are applicable	Due date of filing return of income of a Partner of the Firm required to furnish audit report for transfer pricing was not in line (Due date was earlier) with due date of filing of return of income of such firm. Hence, it was not practical for partners to file return until the firms return was finalized.	Thus, accordingly the time limit to file return of income for such partners is now being extended to 30 th November of each year and bringing the same in line with the due date of the return for firms.
2	Filing of Revised or Belated Return	As per existing provision, a return of income could be revised or filed belatedly before the end of the succeeding financial year (For returns to be filed for the period 31.03.2021 until 31.03.2022) or completion of the assessment whichever is earlier.	It is proposed that the belated return or revised return can now be filed before 3 months of end of succeeding financial year (For returns to be filed for the period 31.03.2021, the period shall be until 31.12.2021) or before the completion of the assessment, whichever is earlier.

Similarly, Time limit for completion of assessment proceedings for FY 2020-21 and onwards, reduced from the earlier 24 months to 21 months. Consequently, the time-limit for completion of TP assessment proceedings also stands reduced from erstwhile 22 months to 19 months.

- **Amendments to the Vivad se Vishwas Scheme, 2020**

Vivad Se Vishwas Scheme was a very welcome move by the Government introduced with the objective of reducing pending income-tax litigation and generating timely revenue by the Government and to bring peace of mind and certainty to the tax payers. This scheme has received a thumping response and many appeals at various forums have been withdrawn by the taxpayers. Considering a very positive response the time limit for filing applications under the Vivad Se Vishwas Scheme has been extended by one month and

can now be filed on or before 28.2.2021.

- **Changes in Assessment Procedure for income escaping assessments.**

Under the existing Provisions of Income Tax, tax officer have the power to assess/reassess the income of the taxpayer in a case where he has reason to believe that income has not been fully disclosed. Further, the provisions enabled the tax officer to complete his assessment on the basis of above and would proceed to reopen/conduct reassessment subject to time limits mentioned below:

Particulars	Time Period
Income Escaped Assessments Below INR 1,00,000 and	Upto 4 years
Income Escaped Assessments INR 1,00,000 or more	Upto 6 years
Non-disclosure of Foreign Assets	Upto 16 years

However, there were huge litigation involved, as the provisions enabled the tax officer to reopen cases/ conduct reassessments as they had the power to complete assessment where they had a reason to believe that income has escaped assessment. This reopening was totally at the discretion of the tax officer i.e. discretionary and was opinion driven, then fact and information driven. This created lot of unwanted litigation and undue hardship to taxpayers. Hence, this budget proposes to revamp this procedure of conducting certain kinds of assessment.

Since lot of information today is readily available, in contrary to the existing provisions now the tax officer has to first conduct inquiries and also provide opportunity of being heard to the taxpayer along with obtaining approval from higher tax officials for forming an opinion that income has escaped assessment. Thus, only after giving adequate opportunity of being heard, can the tax officer issue a reopening / reassessment notice. However, this procedure shall not be followed in search or survey cases.

Any reliable information received from CAG or gathered during search or survey or flagged by Computer system of CBDT shall aid the tax officer in forming the said opinion.

Further, the revised Time limit for issuing notice for reopening / reassessment is as follows

Income that has Escaped assessments:	Time Period
Below INR 50 lakhs and below	Upto 3 years
INR 50 Lakhs and above	Upto 10 years

Chapter 5: Tax Provisions Pertaining to TDS & TCS.

- **Tax Deduction at Source (TDS) on purchase of goods:**

The Budget proposes to introduce TDS to be deducted by any person i.e. the buyer, for payments exceeding INR 50 lakhs (in one financial year) to a resident seller towards purchase of goods. It is worthy to note that “Buyer” means a person whose total sales/turnover from the business carried on by him exceeds INR. 10 crores during the preceding financial year of the purchase. The rate of TDS would be 0.1% of such sum exceeding INR 50 lakhs.

Further, these provisions shall not be applicable to any transaction on which TDS or tax collection at source (TCS) (**Except TCS under section 206C (1H)**) is already required to be carried out under any other provisions of the Income Tax Act i.e. the above mentioned provision of TDS shall not apply if TDS or TCS is already applicable because of the purview of some existing TDS/TCS provisions.

For your ready reference lately introduced Section 206C (1H) governs TCS provisions whereby every seller who receives sale consideration in excess of INR 50 lakhs, is required to collect 0.1% of the amount as TCS from the buyer at the time of receipt of payment. Thus, wherever TCS is required under sub-section (1H) of section 206C i.e. as well as TDS under the above captioned subject, then on that transaction only TDS under this section shall be carried out **(Thus, TCS not required)**.



The Budget also proposes that where TDS is required to be deducted for the above mentioned transactions and Permanent Account Number (PAN) is not provided

by the recipient, then TDS shall be at the rate of 5% instead of 0.1%

The proposed amendments will take effect from 01.07.2021.

- **TDS/TCS on non-filer at higher rates:**

As per the existing provisions, non-furnishing of PAN results in higher rate of TDS and TCS deductions. Higher rates than normal, acts as deterrent and this has resulted into taxpayers obtaining PAN wherever required and applicable.

Accordingly, the Budget proposes to provide for higher rates of TDS and TCS even in respect of persons (other than NRI's) who have

- 1) Not filed their Income Tax Returns for 2 years immediately prior to the year in which TDS or TCS is required to be done and for which the time limit of filing Income Tax Return has already expired; and
- 2) The aggregate of TDS and TCS is INR 50,000 or more in each of these two years.

The proposed rate of TDS or TCS will be higher of the following rates:

- a) Twice the rate specified in the relevant provision of the Act / or rates in force; or
- b) 5% rate

The proposed rules shall not apply where TDS is required to be made for payments towards salaries.

If the person is covered under higher rates of TDS/TCS due to non-furnishing of PAN, in addition to the proposed provisions, the tax shall be deducted at higher of the two rates provided in the proposed sections and in the existing provisions.

The proposed amendments will take effect from 01.07.2021.

Chapter 6: Anti Abusive Tax Measures

- **Provisional attachment of properties for levy of penalty in case of falsification of accounts:**

Under the existing provisions, in the case of any ongoing tax scrutiny where the tax officers have a reason to believe that the tax payer would not have disclosed his income appropriately, then to protect the interest of the government, the tax officer may provisionally attach any property of such taxpayer, for a period of 6 months. Further, it was always possible for the taxpayer to furnish a bank guarantee of the value of the property so attached, for revoking such provisional attachment of the property. The above bank guarantee would then be invoked only if the tax payer fails to pay his tax demand on time.

Now, in this budget the powers of attachment of the property are being extended in cases where penalty

above INR 2 crores for falsification of books of accounts, is being levied on tax payers.

It is to be noted that a penalty may be imposed on a taxpayer who makes a false entry or omits an entry from his books of accounts. As per the Tax Department, upon initiation of such penalty proceedings, it is highly likely that the taxpayer may also evade the payment of such penalty, if imposed. Hence, in order to protect the interest of revenue, it is proposed to enable the tax officers with powers to provisionally attach the property of the taxpayer during the pendency of proceedings for imposition of penalty for falsification of Books of Accounts if such penalty exceeds INR 2 Crores.



This amendment will take effect from 01.04.2021

- **Taxability of interest from Provident Fund in the hands of employee :**

Under the existing provisions, any interest on contribution to provident fund as well as the accumulated balance becoming due and payable to employees from a Recognized Provident Fund is exempt.

However, this Budget proposes that the above exemption shall not apply to the extent of interest income where the aggregate of amounts of contribution made exceeds INR 2,50,000. (Withdrawal of accumulated balance continues to remain exempt)

Thus, interest earned on the excess of the investments made beyond INR 2,50,000 shall be taxable in the hands of the employee.

The said amendment will be applicable from 01.04.2021

- **Taxation of proceeds of high premium unit linked insurance policy (ULIP):**

ULIP is as a life insurance policy which has components of both investment and insurance.

Under the existing provisions of the Income Tax Act, any sum received under a life insurance policy, including the sum allocated by way of bonus on such policy in respect of which the premium payable for any of the years during the terms of the policy does not exceed 10% of the actual capital sum assured is exempt from tax [Section 10(10D)].

Further, there is no cap on the amount of annual premium that can be paid by any taxpayer during the term of the policy.

Thus, as per the tax department this was being used by certain set of high networth individual taxpayers as a tool to avoid taxes by paying high amounts of premium (subject to the 10% condition) which on receipt would be tax free in the hands of the policy holder.

Thus, it is now being proposed that the exemption in respect of taxability of funds received by the policy holder shall not apply with respect to any ULIP issued (in single or in aggregate of different policies) on or after the 01.02.2021, if the amount of premium payable for a single year during the term of the policy exceeds INR 2,50,000.

The exemption shall continue to remain in place if the sums are received on the death of a person to his / her nominees

Further it is proposed to consider ULIP having premium payable in excess of INR 2,50,000 as a “Capital Asset” and under “equity-oriented funds” thereby providing the mechanism to compute capital gains as well as STT on sale/redemption of such ULIP’s.

The said amendment will be applicable from 01.04.2021

FIRST CHOICE
IN TECHNOLOGY AND SERVICE

KHS

Filling and Packaging - Worldwide



***Totally cool,
they can do
everything!***



Filling :

All types of beverages. In glass and PET bottles, cans, and kegs. With filling level, volumetric, or ACF filling technologies.



Labelling :

Hotmelt, coldmelt. Paper, film, adhesive pressure. Body, back, neck, tamper-evident, wrap-around, and sleeve labelling.



Packing and Palletizing :

Beverages, food and non-food in crates, cases, trays, and shrink packs.

Technically perfect. Gentle product handling. Highly efficient. Highly economical. Profit from these benefits for yourself and for your customers.

KHS MACHINERY PVT. LTD.

Works : Near Hirapur Chowkadi, Vatva-Mahemdabad Highway, Ahmedabad - 382 435, India.

Phone : +91-79-6610 0000 • Fax : +91-79-6610 0010

E-mail : khs@khsindia.com • Website : www.khs.com

Sales Office : 15, Madhuban, Nr. Madalpur Underbridge, Ellisbridge, Ahmedabad - 380 006, India.

Phone : +91-79-2644 0331, 2644 3236

Fax : +91-79-2644 5146

Delhi Office :

Phone : +91-11-2370 9055, 2370 9044

Fax : +91-11-2370 9033

Mumbai Office :

Phone : +91-22-2920 4851

Fax : +91-22-2920 4306

Chennai Office :

Phone : +91-44-4203 7010

Fax : +91-44-4551 4151

Hyderabad Office :

Phone : +91-40-6581 2317

- **Eliminating possibility of double deduction in case of Charitable Trusts and Institutions while calculating application and accumulation.**

- A) Under the existing Income Tax provisions, all charitable trusts are required to expend at least 85% of their Income thereby being permitted to accumulate not more than 15% of such income, that too for a period of 5 years. It is to be noted that specific donations made to a trust would not form part of the Total Income. However, while expending this donation received, towards the specific direction of the donor, charitable trusts considered these amounts as expended and consider it for the purpose of computing 85% application of funds. This resulted into a double deduction and unintended benefit for the trusts. Since amounts expended as the donation/corpus received never formed the part of the income, however the usage of this corpus towards specific direction was being considered as a part of application.
- B) In another instance it was also brought to the notice of Tax Department, that many a times these trusts / institutes would apply for loans / borrowings. Now while using these proceeds from loans / borrowings, the trusts would consider the amount expended as a part of computing 85% application of funds. Further, when such loans / borrowings were repaid then these trusts would again consider loans repaid also as part of computing 85% application of funds thereby resulting into double deduction.

Thus, the Budget proposes the following amendments:

- a) Voluntary contributions made with a specific direction should be invested only as per modes specified. Further, application out of corpus shall not be treated as application of income for charitable or religious purposes. However, when it is invested or deposited back into one or more of the forms or modes specified, such amount shall be allowed as application in the year in which it is deposited back to corpus.
- b) Application from loans and borrowing shall not be considered as application of income for charitable or religious purposes. However, when such loan or borrowing is repaid from the income of the previous year, such repayment shall be allowed as application.
- c) Based on certain judicial precedents, excess of application in the previous years could be set off against the application requirement of subsequent years. However, this budget specifically overrides such judicial judgments by way of introducing a law which prohibits set off or deduction or allowance of any excess application of any previous years.

This amendment will take effect from 01.04.2021

- **Professional can no longer take benefit of presumptive taxation method if operating under a LLP structure.**

Under the existing provisions, Professional Firms have an option to pay their Income tax under the presumptive method of taxation (i.e. 50% of their gross receipts without considering any expenses) provided their gross receipts are lesser than INR 50 Lakhs. These provisions were applicable to all professionals i.e. Sole proprietors, Partnership Firms, LLP's etc. The rationale of giving such a benefit was to remove administrative burden of small professionals from maintaining books of accounts.

However, since LLP's are mandatorily required to maintain the books of accounts and get the audit done (incase of turnover exceeding INR 40 Lakhs) under the LLP Act, this budget removes the dichotomy whereby it is being proposed that the benefit of presumptive method of calculation shall not apply to professionals operating vide a LLP.

This amendment will be effective from 01.04.2021

- **Payment by employer of employee contribution to a fund on or before due date:**

As per the existing provisions, it is permissible for the employer to deposit his share of contribution towards the welfare funds such as Provident Fund, Super Annuation fund, ESIC fund etc on or before the due date of filing the income tax return (due dates mentioned in the welfare acts were not applicable and to that an extent the deadline for payment of employer's contribution was relaxed). Thus, if the employer deposits his share of contribution on or before due date of filing his return of income it would still be a tax deductible expenditure.

On the other hand, the employer is required to deposit employee's contribution towards any welfare funds on or before the due date prescribed in that relevant Act i.e. 15th / 21st of the succeeding month etc. as the case may be. The rationale being that it would unjustly enrich the employers to hold back the employee's contribution with them by not crediting the same against the account of the employee with the respective welfare funds at the earliest. However, certain employers were not abiding by these provisions and used to make payments in respect of even employee's contribution not before the due date actually mentioned in the respective act but just before date of filing of return of Income.

This, budget now clarifies that the due date given for crediting the employer's contribution does not apply to payments to be made towards employee's contribution and accordingly all contribution towards welfare funds in respect of employees contribution shall be made before the due dates mentioned in the welfare acts.

The said amendment will be applicable from 01.04.2021

Chapter 7: Certain Measures To Incentivize The Tax Payers

- **Tax Benefits for investing in a Start Up.**


Under the existing laws, an eligible start up can claim deduction of 100% of profits earned from its business for any 3 consecutive years out of 10 years provided the entity was registered as a start up on or before 31.03.2021. The conditions for eligibility are as below:

- a. The entity should have been incorporated after 1st April, 2016
- b. The Startup should be incorporated as a private limited company or registered as a partnership firm or a limited liability partnership
- c. Turnover should be less than INR 100 Crores
- d. Aggregate amount of paid up share capital and share premium of the Startup does not exceed INR 25 Crore
- e. The Startup should be working towards innovation / improvement of existing products, services and processes and should have the potential to generate employment and create wealth.
- f. It should not be formed by splitting up or reconstruction of an existing business shall not be considered a "Startup"
- g. The entity should be a DPIIT recognized Startup



An entity shall be considered as a startup up to 10 years from the date of its incorporation. **Now, the budget provides for extending this benefit to entities who are eligible to register as a start up until 31.03.2022.**

Further, under the existing provisions, any gains arising from transfer of residential property by an Individual or an HUF, can be claimed to be exempted, if the proceeds from sale of such residential property are invested in an eligible start up. The conditions to claim this exemption by Individuals / HUF's are as below



- a. The net consideration from sale of residential property (a house or a plot of land held for 3 years atleast) is invested before the date of filing the return
- b. The eligible start up will expend this money for purchase of new asset within 1 year of receipt of the money

c. The residential property is transferred on or before 31.03.2022 (This budget has extended this time limit from 31.03.2021 to 31.03.2022, to encourage investments in startup's)

- **Permitting the Issuance of zero coupon bond by infrastructure debt fund:**

A zero-coupon bond is a debt security that does not have to pay interest during the life of the bond but instead is issued at a deep discount, thereby rendering a profit at maturity, when the bonds are redeemed for its full face value.

The budget proposes to amend provisions under the Income Tax Act pertaining to definition of Zero Coupon Bond in order to enable even **“infrastructure debt funds”** to issue Zero Coupon Bonds to prospective investors. (erstwhile a zero coupon bond was permitted to be issued only by infrastructure capital company/fund).

The said amendments will be applicable from 01.04.2021

- **Increase of threshold limit of exemption for certain entities:**

Under the existing provisions, *income received by any person (such as colleges, medical college etc) on behalf of a university/ educational institution/hospital (trust/institutes registered under 12AA) existing solely for their inherent purpose and not for profits is exempt*, subject to the condition that the annual receipts of such university/ educational institution/hospital does not exceed INR 1 Crore.

In order to ensure that this benefit continues to be made widely available to small trusts and institutions, the Budget proposes to exceed the said limit to INR 5 Crores (from 1 crores)

The said amendment will be applicable from 01.04.2021

- **Amendment in regards to applicability of Tax Audit:**

Every person carrying on business is required to get its accounts audited, if the total sales during the year exceeds INR 1 Crore.

However, businesses where aggregate receipts and payments in cash did not exceed 5% of total receipts / payments, the threshold limit to get the audit done was increased from INR 1 crore to INR 5 crores

Now, this budget proposes to enhance the limits to get the audit done in cases where 95% of total receipts / payments are in electronic mode (not in cash) from existing INR 5 crores to 10 Crores.

This amendment will be effective from 01.04.2021

- **Addressing taxation issue on withdrawing amounts from retirement corpus abroad:**

A common problem faced by many non-resident Indians who have lived considerable time abroad and returned back to India, was in terms of taxation of amounts withdrawn from their retirement accounts in

the foreign countries. In many countries retirement corpus would be taxed only in the year of withdrawal of such amounts, whereas in India such amounts were taxable on accrual basis irrespective of the fact that amount has been withdrawn or not. This gave rise to mismatch of taxability specially in the year of withdrawal of retirement funds thereby potentially giving rise to Double taxation issues.

Hence, in order to address this mismatch, this budget proposes that rules for eliminating this hardship and double tax issues will be framed for the timing, manner of taxation and mode of mitigating double taxation on the foreign retirement corpus of such returning NRIs.

The said amendments will be applicable from 01.04.2021

- **Relaxation for senior citizens from Filing of Income Tax Return**

Senior Citizens aged 75 years or above having only pension and interest income are now exempted from filing income tax returns (Subject to conditions mentioned below). The bank making payments to the senior citizens will deduct the necessary tax after considering the various deductions and rebates eligible to be claimed by the senior citizen (With effect from 01.04.2021)

Conditions to be fulfilled:

1. The senior citizen is resident in India- aged 75 or more
2. Has pension income, interest income both from the same bank
3. Files a declaration of his income, deductions and rebate to the specified bank.
4. Bank is a specified bank as per Govt.

- **Leave Travel Concession CASH SCHEME for employees**

In view of the situation arising out of outbreak of COVID-19 pandemic, it disrupted people's travel plans on account of which employees were not able to utilise the LTC that was pre designed in their salary structures. Accordingly, the Government announced by way of a press release, for payment of cash in lieu of the LTC designed for the employees which would also be exempted from tax. This provision is now made part of the tax laws in this budget. The LTC cash scheme would be tax exempt in the hands of the employees subject to following conditions.

- a. An employee will be eligible for deemed LTC fare (Lower of 36,000 per person of the family or 1/3rd of specified expenditure) which will be exempt
- b. The employee purchases goods or services worth 3 times the deemed LTC fare between 12th October, 2020 to 31st March, 2021
- c. The good or services so procured attract a GST of 12% or more
 - The payment should be made only through digital mode
 - The LTC is available once in the block period of calendar year 2018 to 2021
 - This amendment is applicable only for the period 01.04.2020 to 31.03.2021

Chapter 8: International Tax Provisions

- **Extending benefit of TDS rates in case of certain income earned by the Foreign Portfolio Investors (FPI's):**

As per the existing provisions, TDS is deductible on certain income (income other than by way of Interest covered under section 194LD) of the FII's that they earn from securities at a flat rate of 20%. Since the said rules provides for TDS at a specific rate, the deduction is to be made at that specified rate and the benefit of lower rate if any that is mentioned in the Double Taxation Avoidance agreements (DTAA) cannot be given at the time of tax deduction.

Realizing that this was not the intention and rationalizing the laws to extend the benefit of deducting TDS at the rate of 20% or the rates mentioned in the DTAA, whichever is lower an amendment has been brought in. Hence, all income shall be subjected to TDS at the rates prevalent in India or mentioned in DTAA whichever is favourable.

This amendment will take effect from 01.04. 2021.

- **Definition of the term “Liable to Tax”:**

Under the existing tax provisions any individual who is a citizen of India having Indian source of Income in excess of INR 15 lakhs is deemed to be a “tax resident” of India, if he is not liable to tax in any other country

However, the words “not liable to tax” was not defined anywhere.

Hence, the Budget proposes to provide the definition of the term “liable to tax”. It means that there is a liability of tax on a person under the law of any country and will also include a case where subsequent to imposition of such tax liability, an exemption has been provided.

E.g. A citizen of India has been living in UAE for the past 15 years. Now there is no tax laws in force in UAE, thus the person who is resident in UAE is obviously not liable to pay tax in UAE. Consequentially with the amendment above he may be considered as a Resident of India.

The said amendment will be applicable from 01.04.2021

- **Equalisation Levy on E commerce Operators:**

Currently Equalization Levy (EL) is levied at the rate of 2 percent of the amount of consideration received by any E-commerce operator from Ecommerce supply of goods or services provided or facilitated by it to a person resident in India. Thus, for every supply of goods or service by an e commerce operator to an Indian Resident an EL is levied at the rate of 2% in India.

As a corollary to this tax treatment, Indian Income tax provisions exempts the income arising to the Ecommerce operator, to the extent it was chargeable to equalization Levy.

In order to clarify various provisions concerning this levy, it is proposed to carry out the following amendments:



- a. consideration received against e-commerce supply or services shall not include consideration which are taxed as “royalty” or “fees for technical services”. Royalty and FTS would be taxed in the hands of e commerce operator as per the tax provisions of Royalty and FTS and a lesser EL would not be imposed.
- b. For the purposes of defining e-commerce supply or service, “online sale of goods” and “online provision of services” shall include one or more of the following activities taking place online:
 - i) Acceptance of offer for sale;
 - ii) Placing the purchase order;
 - iii) Acceptance of the Purchase order;
 - iv) Payment of consideration; or
 - v) Supply of goods or provision of services, partly or wholly
- c. Consideration received or receivable from e-commerce supply or services shall also include consideration for sale of goods or provision of services irrespective of whether the e-commerce operator owns the goods or has provided the service himself.

These amendments will take effect from 1st April, 2021.

Chapter 9: GST (Indirect Taxes)

- **Principle of mutuality is done away by amending the definition of word “Supply”**

- This Budget has proposed to expand the scope of word ‘supply’ under the GST that too retrospectively from 1st July, 2017 to include the activities or transactions between mutual associations and its members
- Thus, It is now clarified that associations (whether incorporated or not) and its members shall be deemed to be two separate persons and any activities or transaction inter-se shall be deemed to be supply from one person to another and thereby liable to GST
- Consequently, all mutual associations such as co-operative housing societies, member’s clubs, trade associations, professional associations etc. will be liable to GST on supply of goods or services to its members retrospectively from 1st July, 2017.
- Though most of the associations had already adopted this view whereby they were charging GST since inception, there was an ongoing litigation in many cases across India and hence this retrospective clarification will put disputed matters at rest.



- **Requirement of Audit under GST law now no longer required.**

- Under the existing GST laws, every taxpayer exceeding a certain threshold, is required to get GST audit conducted along with submitting a certified reconciliation statement (GSTR 9C) under the GST Act, from a Chartered Accountant or a Cost Accountant.
- It is now proposed to omit the requirement of certifying reconciliation statement in Form GSTR 9C (‘GST Audit’) by a Chartered Accountant or Cost Accountant
- The information required to be furnished in Audit will now be merged with Annual Return (Form GSTR 9). This Annual Return will have to be self-certified by the taxpayers themselves
- It is to be noted that for the year Financial Year 2019-2020 the requirement for GST audit still persists. The year for which no audit will be required shall be notified by the GST council later.

- **Additional eligibility condition for claiming ITC**

Under the existing GST law, in order to avail the Input Tax Credit the following conditions are required to be satisfied.

- To be in possession of the invoice or debit note raised by the supplier
- Should have actually received the goods or services
- GST should have been paid by the supplier to the government (By way of cash or utilization of ITC)
- Should have filed the GST returns.
- Now, apart from the above conditions, It is proposed that taxpayer will be eligible to claim ITC on supplier’s invoices or debit notes only if such invoice or debit note is declared by the supplier in its statement of outward supply (i.e. Form GSTR-1) Taxpayer will not be entitled to claim ITC until the vendor files Form No GSTR 1 reflecting above referred Invoice or Debit Note

- This will cast an onus on taxpayer to ensure that his vendors are compliant and disciplined. These provisions were already forming part of the rules but not of the act. Hence, the same has been made part of the Act under this Budget
- Further, a view may also be taken that if any amount is declared in GSTR-1 but not paid vide GSTR-3B, then recovery proceedings can be initiated directly without issuing any Show Cause Notice.
- **All Supplies to SEZ will not automatically qualify as a zero rated supply**
 - Under the existing GST provisions, Supply of goods or services to SEZ would qualify as zero rated supplies thereby eligible for refund subject to fulfillment of other conditions.
 - Now it is being proposed that Supply of goods or services to SEZ shall qualify as zero rated supplies only if such supply is to be used for authorized operations (exports) by SEZ unit or SEZ developer.
 - Further, It can be said that any supply provided to SEZ unit or SEZ developer which do not qualify as authorized operation would be subject to GST.
- **Criteria for eligibility of Refund of IGST to be specified & refund liability with interest- Export Proceeds Not Realized Within Time**
 - Presently, the exporter of any goods or services are entitled to refund of IGST paid on such exports
 - Now It is being proposed that such refund will be allowed only in case of notified class of taxpayers or notified goods or services (To be notified later). The rest will be allowed to claim only the balance of unutilized ITC as a refund.
 - Further, it is being proposed that suppliers exporting goods without payment of tax shall be liable to get back refund only if the proceeds against such exports are received within the time frame given under the FEMA provisions.
 - The refund received by such exporters shall have to be paid back to the government with interest on failure to realize the export proceeds within the time prescribed under FEMA
- **Increase in Penalties in case of detention & seizure:**

Presently there are certain situations (such as, goods transported without tax invoice, E way bill violation etc.) where Goods being transported can be confiscated by the GST Authorities. In this regards, certain penalties are imposed to reclaim the goods confiscated by the GST Authorities as below which are proposed to be increased in this budget.

In case of detention and seizure, the goods	Existing	Proposed
Where <u>owner of goods comes forward</u> for payment of such tax and penalty	Penalty equivalent to <u>100% of tax payable</u> on goods	Penalty equivalent to <u>200% of tax payable</u> on goods
In case the <u>owner does not come forward</u> for payment of tax	Penalty equivalent to <u>50% of the value of the goods</u> reduced by the tax amount paid thereon	Penalty equivalent to <u>50% of the value of Goods or 200% of tax payable on such goods, whichever is higher</u>

- **Releasing Goods on Provisional Basis on Furnishing Bond/Security:**

Goods Confiscated as above ***could be released on provisional basis*** upon taxpayer executing a bond and furnishing of security equivalent to the penalty amount in favour of the Government. However, now the goods cannot be released on a provisional basis just by execution of the bond and furnishing of security

Now, the GST tax officer shall be required to first issue a notice within 7 days of detention or seizure of goods and conveyances specifying the penalty payable. **Officer is further required to pass an order within the period of 7 days from the date of service of notice**, and only then can the goods be released.

Further, In case of non-payment of penalty within 15 days of receipt of the order, the concerned GST authorities is empowered to sale or dispose of goods or conveyance so detained for recovery of penalty

Also it should be noted that the transporter may seek release of his vehicle only on payment of penalty or INR 1 lakh, whichever is less.

- **Pre-deposit amount increased to 25% for filing an appeal in case of detention/seizure:**

Under the existing GST regulations in matters of detention or seizing of goods or a transport vehicle confiscated by GST department, and where a tax payer wishes to file an appeal with the GST tax department, payment of 10% of penalty in question (Pre deposit) needs to be made in order to be eligible to file an appeal.

This budget proposes to increase this pre deposit amount to 25%, in case the taxpayer wishes to file appeal against the order.

- **Penalty proceedings in case of proceedings against the supplier and transports together**

Under the existing GST regulation, in case of detention and seizure of goods, when notice is sent to both i.e. supplier and the transporter, and if the supplier has paid the penalty, then it is deemed that penalty proceedings against the transporter is closed.

Now, in this budget, it is propped to delink penalty proceedings on supplier and transporter. Thus, where penalty proceedings are initiated in respect of detention, confiscation or seizure of goods and / or vehicle, proceedings against transporter will not automatically result into a closure of proceedings against the supplier.

The transporter shall have to independently close the penalty case filed by the GST department.

- **Power of provisional attachment enhanced:**

- Presently power of provisional attachment was restricted to non-filers of returns, unregistered persons, inspection, search and seizure, non-payment of demand etc. Further, such provisional attachment was restricted only to assets of the taxpayer in default.
- Now, it is proposed to enhance power of provisional attachment further even in the cases of short payment of self-assessment, provisional assessment and scrutiny of returns as well.
- Further, the provisional attachment can now be done not only in respect of assets of defaulting tax payer but also any other person who unlawfully retains the benefit of this unlawful transaction

- **Interest will be computed on net tax liability - clarified:**

- There were huge amounts of litigations in regards to whether interest should be charged on net tax liability outstanding (GST payable less eligible Input tax credit) or on a gross tax liability outstanding (Total GST payable)
- Accordingly, it was earlier notified that interest was leviable on net tax liability (i.e. after setting off Input Tax Credit) and not on gross tax liability with effect from 1st September, 2020
- However, inspite of the clarification there was an issue regarding the demands outstanding as on and prior to the date of the clarification i.e. for the period 1st July, 2017 to 31st August, 2020
- Thus, it is now proposed in this budget to make above referred beneficial amendment effective from 1st July, 2017.

Membership Renewal Fees Information

Table A: Annual turnover mentioned as below for Corporate Membership Renewal

Consolidated Total Revenue	Annual Subscription	GST	Total Amount
Not exceeding Rs.500 crores	10,000	1,800	11,800
Exceeding Rs.500 crores but not exceeding Rs.1000 crores	20,000	3,600	23,600
Exceeding Rs.1000 crores but not exceeding Rs.1500 crores	30,000	5,400	35,400
Exceeding Rs.1500 crores but not exceeding Rs.2000 crores	40,000	7,200	47,200
Exceeding Rs.2000 crores but not exceeding Rs.2500 crores	50,000	9,000	59,000
Exceeding Rs.2500 crores but not exceeding Rs.3000 crores	60,000	10,800	70,800
Exceeding Rs.3000 crores but not exceeding Rs.3500 crores	70,000	12,600	82,600
Exceeding Rs.3500 crores	80,000	14,400	94,400

Every Corporate Member shall be required to pay the annual subscription fees in advance i.e. between 01st November to 31st of March of the relevant previous year in the current year.

Ordinary Member

Table B: GENERAL MEMBERSHIP RENEWAL BEFORE MARCH 31, 2021

ADVANCE SUBSCRIPTION RENEWAL FEES YEAR WISE SUMMARY									
CATEGORY	LOCAL								
	For 1 Year			For 2 Years			For 3 Years		
	AMT	GST	TOTAL	AMT	GST	TOTAL	AMT	GST	TOTAL
ASSOCIATION/CHAMBER	1,500	270	1,770	2,900	522	3,422	4,200	756	4,956
INDIVIDUAL/FIRM/LLP	1,200	216	1,416	2,300	414	2,714	3,300	594	3,894
PRIVATE LTD	1,500	270	1,770	2,900	522	3,422	4,200	756	4,956
PUBLIC LTD	3,000	540	3,540	5,800	1,044	6,844	8,400	1,512	9,912
PVT TRUST	1,200	216	1,416	2,300	414	2,714	3,300	594	3,894

CATEGORY	REGIONAL								
	For 1 Year			For 2 Years			For 3 Years		
	AMT	GST	TOTAL	AMT	GST	TOTAL	AMT	GST	TOTAL
REGIONAL CHAMBER	3,000	540	3,540	5,800	1,044	6,844	8,400	1,512	9,912
ASSOCIATION/CHAMBER	1,500	270	1,770	2,900	522	3,422	4,200	756	4,956
INDIVIDUAL/FIRM/LLP	1,000	180	1,180	1,900	342	2,242	2,700	486	3,186
PRIVATE LTD	1,500	270	1,770	2,900	522	3,422	4,200	756	4,956
PUBLIC LTD	3,000	540	3,540	5,800	1,044	6,844	8,400	1,512	9,912
PVT TRUST	1,200	216	1,416	2,300	414	2,714	3,300	594	3,894

The Applicant has to attach the cheque for the applicable amount including GST drawn in favour of Gujarat Chamber of Commerce & Industry.

National & International Trade Fairs

International Trade Fairs

Name	Date & Month	Location	Sector
Gulfood	21-25 Feb 2021	Dubai, UAE	Food and Beverages
Agritech	24-26 Feb, 2021	Osaka, Japan	Agricultural Technology
Interpack	25 Feb-3 Mar, 2021	Dusseldorf, Germany	Packaging
The Gem Expo	12-14 Mar, 2021	Toronto, Canada	Gems and Jewellery
Korea International Medical & Hospital Equipment Show	18-21 Mar, 2021	Seoul, South Korea	Medical and Pharma
Vietnam International Furniture & Home Accessories Fair	10-13 Mar, 2021	Ho Chi Minh, Vietnam	Building and Construction
INLEGMASH	1-4 Mar, 2021	Moscow, Russia	Light Industry, Technical Textiles and Nonwovens
BETT ASIA	2-3 Mar, 2021	Kuala Lumpur, Malaysia	Education, Learning Technologies, Information and Communication Technologies
GLOBAL FOOD SAFETY CONFERENCE	2-4 Mar, 2021	Seattle, WA, USA	Food Safety and Agriculture
World Smart Energy Week	3-5 Mar, 2021	Tokyo, Japan	Photovoltaic, Smart Grid and Battery
IDEB	2-4 Mar, 2021	Bratislava, Slovakia	Defense
DRUPA	20-30 Apr, 2021	Dusseldorf, Germany	Printing
Automation World	10-12 Mar, 2021	Seoul, South Korea	Automation Technologies
Garmentech	25-27 Mar, 2021	Dhaka, Bangladesh	Textile and Textile Machinery

National Trade Fairs

Name	Date & Month	Location	Sector
Aero India	Wed, 03 - Fri, 05 Feb 2021	Bengaluru	Aerospace, Defence & Civil Aviation
Industrial Expo Ankleshwar (IEA)	Thu, 04 - Sat, 06 Feb 2021	Ankleshwar	Chemicals and Dyes, Industrial Products
MachAuto Expo	Fri, 19 - Mon, 22 Feb 2021	Ludhiana	Machine Tool and Automation Technology
Surat Sparkle Gems And Jewellery Exhibition	Sat, 20 - Mon, 22 Feb 2021	Surat	Gems and Jewellery
National Garment Fair	Mon, 22 - Wed, 24 Feb 2021	Mumbai	Garments and Apparel
India International Travel Mart Pune (IITM)	Tue, 23 - Wed, 24 Feb 2021	Pimpri-Chinchwad	Travel, Tourism, Recreational & Other Hospitality Services
Rajkot Machine Tools Show (RMTS)	Wed, 24 - Sat, 27 Feb 2021	Rajkot	Machine Tools & Engineering
International Engineering & Technology Fair (IETF)	Thu, 25 - Sat, 27 Feb 2021	New Delhi	Engineering and Technology
Global Logistics Show	Thu, 25 - Sat, 27 Feb 2021	Mumbai	Logistics
Indian Ceramics Asia	Wed, 03 - Fri, 05 Mar 2021	Gandhinagar	Ceramics and bricks
WATER TODAY'S WATER EXPO - CHENNAI	Thu, 04 - Sat, 06 Mar 2021	Chennai	Water and Water Technologies Industry
Travel & Tourism Fair-Ahmedabad (TTF)	Thu, 04 - Sat, 06 Mar 2021	Ahmedabad	Travel and Tourism
Pharma Tech Expo	Wed, 10 - Fri, 12 Mar 2021	Ahmedabad	Pharmaceuticals
AAHAR - International Food & Hospitality Fair	Tue, 09 - Sat, 13 Mar 2021	New Delhi	Food & Hospitality
Paperworld India (PWI)	Thu, 11 - Sat, 13 Mar 2021	Mumbai	Paper Industry
PAINTINDIA	Thu, 11 - Sat, 13 Mar 2021	Mumbai	Paints

MISFORTUNE.

There is only one thing in our control, our 'now'.
While we cannot control what the future has in store
for us, we can take decisions now that can help us later.

Insurance is probably one of those decisions that helps
us **'miss' the 'misfortune'**.

At Digit Insurance, we make this decision simple for you
by offering you an umbrella of insurance products for
your **Property, Employees, Commercial Vehicles,
Stock and Shipment to name a few.**


Know more about Digit Insurance:
www.godigit.com | 878-0431223

digit INSURANCE

Congratulations



ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ચેમ્બરના પ્રમુખશ્રી નટુભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ શ્રી કે. આઈ. પટેલ નું કરવામાં આવેલ સન્માન તા - ૦૨/૧૧/૨૦



We Congratulate our member Shri Yogesh Shridhar as their Educational Institute The New Tulip International School had participated in the IOWA State University (USA) competition from India and to achieve 4th position for seeking innovative methods and upcoming challenges for securing more admission from round the Globe.

We congratulate our member Ms. Kavita Modi (Kavita Plastics) for getting recognized by VyaparJagat.com in VYAPAR JAGAT CONVENTION & AWARDS-2020 i.e. MSME Recognition for Making Aatma Nirbhar Bharat Businesses of the year Manufacturing (MSME) in the category of Machinery & Parts Manufacturer of the year.



Important Information

November 2020 Fiscal Deficit stands at 135.1% of actuals to BEs and November 2020 Core infra stands at (-)2.6%


November 2020 Fiscal Deficit stands at 135.1% of actuals to BEs

The gross fiscal deficit of the Central government stands at 135.1% of the actuals to budget estimates (BEs) in November 2020 as compared to 114.8% of the actuals to budget estimates in the corresponding period of the previous year.

The primary deficit and revenue deficit stands at 785.3% and 139.9% of the actuals to budget estimates in November 2020 as compared to 1076.5% and 128.3% of the actuals to budget estimates in the corresponding period of the previous year.

November 2020 Core infra stands at (-)2.6%

The core infrastructure growth stands at (-)2.6% in November 2020 as against (-)0.9% in October 2020. The cumulative growth of core infrastructure during April-November 2020-21 stands at (-)11.4% as compared to 0.3% in April-November 2019-20.



Source: PHD Research Bureau, PHDCCI, compiled from Ministry of Commerce & Industry

The growth rate of Coal stands at 2.9%, Crude Oil at (-)4.9%, Natural Gas at (-)9.3%, Refinery Products at (-)4.8%, Fertilizers at 1.6%, Steel at (-)4.4%, Cement at (-)7.1% and Electricity at 2.2% in November 2020 as compared to 11.7%, (-)6.2%, (-)8.6%, (-)17%, 6.3%, 4%, 3.2% and 11.2% in October 2020, respectively.

PHD Chamber of Commerce and Industry

RBI announces On Tap Targeted Long-Term Repo Operations – Extension of Specific Sectors

As announced in the Statement on Developmental and Regulatory Policies on December 04, 2020, it has been decided to cover stressed sectors under the On Tap TLTRO Scheme, in synergy with the credit guarantee available under the Emergency Credit Line Guarantee Scheme (ECLGS 2.0) of the Government.

Accordingly, in addition to the five sectors announced under the On Tap TLTRO Scheme on October 21, 2020, the twenty-six stressed sectors notified under ECLGS 2.0 (identified by the Kamath

Committee of RBI) have been brought within the ambit of the sectors eligible under the On Tap TLTRO scheme. The stipulation under ECLGS 2.0 that only entities with outstanding between ₹50 crore and ₹500 crore shall be eligible for the credit guarantee shall, however, not apply to funds availed under On Tap TLTRO.

All other terms and conditions of the scheme remain the same.

PHD Chamber of Commerce and Industry


GST Revenue collection for December 2020 recorded all time high since implementation of GST

The gross GST revenue collected in the month of December 2020 is ₹ 1,15,174 crore of which CGST is ₹ 21,365 crore, SGST is ₹ 27,804 crore, IGST is ₹ 57,426 crore (including ₹ 27,050 crore collected on import of goods) and Cess is ₹ 8,579 crore (including ₹ 971 crore collected on import of goods). The total number of GSTR-3B Returns filed for the month of November up to 31st December 2020 is 87 lakhs.

The government has settled ₹ 23,276 crore to CGST and ₹ 17,681 crore to SGST from IGST as regular settlement. The total revenue earned by Central Government and the State Governments after regular settlement in the month of December 2020 is ₹ 44,641 crore for CGST and ₹ 45,485 crore for the SGST.

In line with the recent trend of recovery in the GST revenues, the revenues for the month of December 2020 are 12% higher than the GST revenues in the same month last year. During the month, revenues from import of goods was 27% higher and the revenues from domestic transaction (including import of services) are 8% higher than the revenues from these sources during the same month last year.

The GST revenues during December 2020 have been the highest since the introduction of GST and it is the first time that it has crossed ₹ 1.15 lakh crore. The highest GST collection till now was ₹ 1,13,866 crore in the month of April 2019. The revenues of April normally tend to be high since they pertain to the returns of March, which marks the end of financial year. The December 2020 revenues are significantly higher than last



month's revenues of ₹ 1,04.963 crore. This is the highest growth in monthly revenues since last 21 months. This has been due to combined effect of the rapid economic recovery post pandemic and the nation-wide drive against GST evaders and fake bills alongwith many systemic changes introduced recently, which have led to improved compliance.

Till now, GST revenues have crossed ₹ 1.1 lakh crore three times since introduction of GST. This is the third month in a row in the current financial year after the economy has been showing signs of recovery post pandemic that the GST revenues have been more than ₹ 1 lakh crore. The average growth in GST revenues during the last quarter has been 7.3% as compared to (-) 8.2% during the second quarter and (-) 41.0% during the first quarter of the financial year.

The chart below shows trends in monthly gross GST revenues during the current year.


(Source: PIB, GoI)
Courtesy - ASSOCHAM



7 SEASONS
RESORT & SPA



A RESORT SURROUNDED BY
GREENERY AND A RANGE OF FUN ACTIVITIES.



SWIMMING POOL



RESTAURANT



SPA



GAMING ZONE



MINI THEATRE



TODDLER'S AREA



COFFEE SHOP



PARTY PLOT



CONFERENCE HALL



BANQUET HALL



LOUNGE



LIBRARY

© TRIMBLE

For more details call us : +91 70690 88803 / 04 / 10
7 season Resort & Spa, Lakhavad, Dwarika highway, Jamnagar.

Regional Chambers Activities

Rajkot Chamber of Commerce & Industry



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવનિયુક્ત થયેલ એરપોર્ટ ડાયરેક્ટર શ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઈ રાજકોટના એરલાઈન્સને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજકોટના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી પંકજકુમાર રોયની મુલાકાત લઈ હાઈવે તથા ઓવરબ્રિજને લગતા પ્રશ્નોની રજૂઆત કરાયેલ.



રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિની યોજાયેલી મિટિંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવે ઉપસ્થિત રહી એરલાઈન્સને લગતા પ્રશ્નોની રજૂઆત કરેલ.

Saurashtra Chamber of Commerce & Industry

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રના માન. શિપિંગ, કેમિકલ્સ અને જળ-પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સાથે ભાવનગરના વિકાસને ગતિ મળે તે અંગેના વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ

કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી કિરીટભાઈ સોની દ્વારા શાબ્દિક સ્વાગત કરવાની સાથે-સાથે જણાવાયેલ કે ભાવનગર પાસે જે સંસાધન છે તેની ઓળખ

મનસુખભાઈએ કરાવેલ છે. જળ-પરિવહનનો પ્રારંભ શ્રી મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદૃષ્ટિ અને સખત પ્રયત્નોના કારણે થયેલ છે અને તેના કારણે ભાવનગર અને દક્ષિણ ગુજરાત



નજીક આવેલ છે. હાલ ભાવનગરમાં જે સંસાધન છે તેમાં મીઠા આધારિત ઉદ્યોગો, ભાવનગરથી મુંબઈ, રત્નાગીરી, કોઈમ્બતૂર વગેરેની પણ સી-કનેક્ટિવિટી શરૂ થાય, પ્લાસ્ટિકપાર્ક, મીઠીવીરડી ખાતે બારમાસી બંદર, ભાવનગર પોર્ટ ડેવલપમેન્ટ, જેટી રિપેરિંગ વગેરે બાબતો અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવું સૂચન કરેલ.

શ્રી મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત મહાજન છે અને તેની કામગીરી પોલાઈટ અને પોઝિટિવ છે તેમ જણાવેલ. ભાવનગરના વિકાસ અંગે ચર્ચા કરતાં તેઓએ જણાવેલ કે આગામી બે વર્ષમાં ભાવનગરનો રોડ કનેક્ટિવિટીનો પ્રશ્ન હલ થાય તે અંગેના સખત અને સતત પ્રયત્નો ચાલુ છે. આ ઉપરાંત ભાવનગરથી મુંબઈ, મુન્દ્રા, મૂળ દ્વારકા, રત્નાગીરી અને કોચિન સી-કનેક્ટિવિટી શરૂ થાય તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે. તેના કારણે કોસ્ટલ કાર્ગોનું પ્રમાણ ખૂબ જ વધશે અને પરિણામ સ્વરૂપે ભાવનગરનું સમગ્ર દેશ સાથેનું અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ભારત સાથેનું પરિવહન સરળ અને ઝડપી બનશે.

ભાવનગર જિલ્લામાં સ્કેપ વિહિકલ માટેનું યાર્ડ બનાવવા માટેના સખત પ્રયત્નો ચાલુ છે. આ ઉપરાંત કોસ્ટલ એરિયામાં પડતર જમીનનો સદુપયોગ કરી ખાનગી ઔદ્યોગિક વસાહતની સ્થાપના થાય તે અંગેની કામગીરી પણ થઈ રહી છે. આગામી એકથી દોઢ વર્ષમાં આલ્કોહ એશડાઉન ધમધમતું થશે તેમ જણાવેલ. સરકારે શિપ રિસાઈકલ માટેનું બિલ પસાર કરી અલંગના વિકાસને ગતિ આપેલ છે અને તેના કારણે દેશભરના તથા વિદેશના શિપ અહિયાં



સ્કેપ થવા માટે આવશે. કન્ટેનરનો વપરાશ દેશભરમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેથી જિલ્લામાં આ ઉદ્યોગ માટે પણ ખૂબ સારી તક છે. પૈસાનું સર્જન કરનારને સન્માનિત કરવા તેવો સરકારનો અભિગમ છે.

IS OF DOING BUSSINESS માટેની પ્રક્રિયા સરળ બનાવવા માટે ઉદ્યોગકાર જાતે સરકારના નિયમોનું પાલન કરશે તે અંગે સેલ્ફ સર્ટિફિકેશન આપે તો સરકારનો કોઈ વિભાગ ત્યાં રૂબરૂ તપાસ માટે જશે નહિ, જેથી ઉદ્યોગકારને સરળતા રહે તે દિશામાં પણ કામગીરી થઈ રહેલ છે. અંતમાં તેઓએ જણાવેલ કે સરકાર, મહાજનો અને પ્રજા બધાં સાથે મળી કામગીરી કરશે તો પરિણામલક્ષી કામગીરી થશે. ભાવનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેમની નૈતિક ફરજ હોવાનું જણાવેલ.

આ પ્રસંગે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિવિધ પ્રશ્નો પૂછવામાં આવેલ તેના શ્રી મનસુખભાઈએ ખૂબ જ સંતોષકારક ઉત્તર આપેલ. આ પ્રસંગે અલંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ચેરમેન શ્રી ગિરીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, શિપ રિસાઈકલિંગ એસોસિયેશન તથા સિહોર સ્ટીલ રી-રોલિંગ મિલ એસોસિયેશન સહિતનાં એસોસિયેશનના હોદ્દેદારો, ચેમ્બરના પૂર્વ પ્રમુખો તથા મેનેજિંગ કમિટીના સભ્યો અને ભાવનગરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. અંતમાં ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત ઉપસ્થિત સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરમાં કન્ટેનર હબની સ્થાપના કરવા માટે વિવિધ પરિબળોનો અભ્યાસ અને વિચાર-વિમર્શ કરવા માટે મિટિંગ યોજાઈ.



કેન્દ્રના શિપિંગ, કેમિકલ્સ અને જળ-પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તાજેતરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવેલ તે સમયે તેઓએ ભાવનગરના સર્વાંગી વિકાસ માટે અલગ-અલગ બાબતો અંગે પ્રકાશ પાડેલ તે પૈકી ભાવનગર જિલ્લોને કન્ટેનરના ઉત્પાદન માટેનું હબ બને તથા વિહિકલ સ્કેપયાર્ડ બને તે અંગેનો વિચાર વ્યક્ત કરેલ. તેમના આ વિચારને મૂર્તિમંત કરવાના ભાગરૂપે આજરોજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક વિચાર ગોષ્ઠી અને B 2 B મિટિંગનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ મંત્રીશ્રી કેતનભાઈ મહેતાએ શાબ્દિક સ્વાગત કરેલ. પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ યોજવામાં આવેલ આ કાર્યક્રમની પૂર્વભૂમિકા આપતાં જણાવેલ કે ભાવનગરને કન્ટેનરના ઉત્પાદન માટેનું હબ બનાવવા અંગેનો આ પ્રયત્ન છે. કન્ટેનરના ઉત્પાદન માટેનાં તમામ પાસાંની જાણકારી આપી શકે તેવા નિષ્ણાતો તથા કન્ટેનરના બાયર પણ અત્રે ઉપસ્થિત છે. તેથી આ દિશામાં આગળ વધવા માટેના આ પ્રયત્નો છે.

પુષ્પક લોજિસ્ટિકના મેનેજિંગ ડાયરેક્ટર અને નેશનલ શિપિંગ બોર્ડના મેમ્બરશ્રી રાહુલભાઈ મોદીએ જણાવેલ કે તેઓ છેલ્લા બે માસથી આ દિશામાં કાર્ય કરી રહ્યા છે અને તેનો સર્વે પણ કરેલ છે. ભાવનગર જિલ્લામાં કન્ટેનરનું હબ બને તે માટે ખૂબ જ ઊજળા સંજોગો છે, કારણ કે કન્ટેનરની માગ દિન-પ્રતિદિન વધી રહેલ છે. દર વર્ષે આ માંગમાં દોઢસો ટકાનો વધારો થાય છે. કન્ટેનરના પાર્ટ્સ બનાવવા માટેનું સ્ટીલ હજારમાં ઉપલબ્ધ છે. તેથી કન્ટેનરના એન્સિલિયરી ઉદ્યોગો માટે પણ ખૂબ સારી તકો છે. આ તકે પુષ્પક લોજિસ્ટિક દ્વારા આજની મિટિંગમાં હાજર રહેલ ઉદ્યોગકારો પૈકી નવસાહસિક ઉદ્યોગકારોને આઠ કન્ટેનર બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવેલ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના જનરલ મેનેજર

(પર્યાવરણ) શ્રી અતુલભાઈ શર્માએ ભાવનગર જિલ્લામાં વિહિકલ સ્કેપયાર્ડ તથા કન્ટેનરનાં ઉત્પાદનનાં એકમો બને તો ખૂબ સારી તકો છે અને બંદર નજીકમાં આ એકમો સ્થપાય તો લોજિસ્ટિક ખર્ચ પણ ઓછો આવે તેમ જણાવેલ.

શિપ રિસાઈકલિંગ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના પૂર્વ સેક્રેટરીશ્રી નીતિનભાઈ કાણકિયાએ જણાવેલ કે આ બંને એકમો માટે ભાવનગર જિલ્લામાં ખૂબ સારી તકો છે અને તેમણે અલંગ આસપાસની પડતર જમીન ફાળવવી જોઈએ. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં તેમનું એસોસિયેશન સહયોગ આપશે.

શિહોર સ્ટીલ રી-રોલિંગ મિલ એસોસિયેશનના પ્રમુખશ્રી હરેશભાઈ ધાનાણીએ ચર્ચામાં ભાગ લેતાં જણાવેલ કે કન્ટેનર બનાવવા માટેનું ઘણું રો-મટીરિયલ ભાવનગર જિલ્લાની રોલિંગ મિલો પૂરું પાડી શકે તેમ છે. તેવી જ રીતે વિહિકલ સ્કેપયાર્ડ બને તો તેનો સ્કેપ પણ રોલિંગ મિલો રો-મટીરિયલ તરીકે ઉપયોગ કરી શકે છે, જેથી આ બંને ઉદ્યોગો થાય તો રોલિંગ મિલ ઉદ્યોગનો પણ વધારે વિકાસ થશે. શિપિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતી ટ્રાન્સવર્લ્ડ કંપનીના જનરલ મેનેજરશ્રી સચીનભાઈ રાઠોડ તથા સૌરભભાઈ રોયે તેમની કંપનીની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવેલ કે તેમની કંપની ૪૦ વર્ષ જૂની છે અને ઘણા દેશોમાં તેમની શાખા આવેલી છે. તેમનો ૬૦થી ૭૦ ટકા બિઝનેસ ગુજરાત સાથે છે તેમજ તેઓની કંપની કન્ટેનરના મોટા બાયર છે. તેઓની કંપની ગુજરાતમાં કામ કરવા ખૂબ જ ઉત્સુક છે આ અંગે તેઓએ પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી કન્ટેનર ઉદ્યોગ અને કન્ટેનરના માર્કેટિંગ અંગે વિસ્તૃત માહિતી આપેલ.

આ પ્રસંગે ચેમ્બરના ઓફિસબેરર્સ, પૂર્વ પ્રમુખશ્રીઓ, શિપ રિસાઈકલિંગ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના માનદ્ મંત્રીશ્રી હરેશભાઈ પરમાર, ભાવનગર ઇન્ડક્શન ફર્નેશ એસોસિયેશનના પ્રમુખશ્રી પ્રકાશભાઈ દોશી તથા વિવિધ એસોસિયેશનના હોદ્દેદારો, ઉદ્યોગકારો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગકાર ભૂમિ એન્ડ ઇન્ડસ્ટ્રીના શ્રી કિરણભાઈ કથીરિયા ખાસ ઉપસ્થિત રહેલ અને ભાવનગરમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ.

કાર્યક્રમનું સમાપન કરતાં ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ જણાવેલ કે આપણને જે બેઝિક માહિતીની જરૂર હતી તે માહિતી આ પ્લેટફોર્મના માધ્યમથી મળેલ છે. આ બંને ઉદ્યોગો શિપિંગને રિલેટેડ હોવાથી તેના માટે ભાવનગર જિલ્લામાં ખૂબ સારી તક છે તેથી આ મિટિંગ પરીણામલક્ષી બની રહેશે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ડેલિગેશને ધોલેરા - સર ની પ્રત્યક્ષ મુલાકાત લીધી.



સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ડેલિગેશને તા.૨૯-૧૨-૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા-સરની પ્રત્યક્ષ મુલાકાત લઈ થયેલ અને થનાર પ્રગતિની ઝાંખી કરી સંતોષની લાગણી વ્યક્ત કરેલ. દોઢ વર્ષ અગાઉ ચેમ્બરના ડેલિગેશને ધોલેરા-સરની મુલાકાત લીધેલ. દોઢ વર્ષના આ સમયગાળા દરમિયાન ધોલેરા-સર ખાતે કામગીરીમાં ઘણી પ્રગતિ થઈ હોવાનું જણાયેલ છે. વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ધોલેરા ખાતે પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપવાની કામગીરી થઈ રહેલ છે તે પૈકી ટાટા કેમિકલ્સ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે અને આગામી સમયમાં લિથિયમ બેટરીનું પ્રોડક્શન શરૂ થઈ જશે. ચેમ્બરની આ ધોલેરા-

સરની મુલાકાતમાં ધોલેરા-સરના કોર્પોરેટ અફેર્સ અને એચઆર હેડ શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ અને મેનેજર બ્રાન્ડિંગ અને માર્કેટિંગ શ્રી કેતનભાઈ વૈદ્યે સાથે રહી ખૂબ જ સારી જાણકારી આપેલ.

ચેમ્બર પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ જણાવેલ કે ધોલેરાથી સૌથી નજીકમાં ભાવનગર જિલ્લો આવે છે. તેથી ધોલેરા અને ભાવનગર વચ્ચેની કનેક્ટિવિટી વધે તો ધોલેરા-સરના વિકાસને વધારે ગતિ મળે. આ માટે ધોલેરા-સર દ્વારા આ કનેક્ટિવિટી વધારે સારી થાય તે માટે પ્રયત્ન થવા જોઈએ તેવી રજૂઆત કરેલ.

ભાવનગરનાં અનેક ઉદ્યોગકારો અને વેપારીઓ ધંધાકીય હેતુ માટે નિયમિત અલંગની મુલાકાત લે છે. ભાવનગરથી અલંગનું અંતર ૫૫ કિલોમીટરનું છે આમ છતાં તેઓ નિયમિત અલંગ ધંધાકીય હેતુ માટે આવન-જાવન કરે છે, જ્યારે ભાવનગરથી ધોલેરાનું અંતર ૬૫ કિલોમીટરનું છે. તેથી ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગકારો ધોલેરા ખાતે પણ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી તેમાં સહભાગી થઈ શકે છે. ચેમ્બરના આ ડેલિગેશનમાં પાંત્રીસ જેટલા વેપારી-ઉદ્યોગકારો અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ સામેલ થયેલ. ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ ચેમ્બરના ડેલિગેશનની આ મુલાકાતમાં સહયોગ આપનાર ધોલેરા-સરના તમામ અધિકારીઓ પ્રત્યે ચેમ્બર વતી આભારની લાગણી વ્યક્ત કરેલ.

Jamnagar Chamber of Commerce Industry



જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) ઓડિટ અંગે જીએસટી વિભાગના અધિકારીશ્રીઓ સાથે એક ઓપન હાઉસ બેઠક તા. ૦૬-૦૧-૨૦૨૧ના રોજ યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં સંસ્થાના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ સ્વાગત કરી

જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી વેપાર-ઉદ્યોગમાં જીએસટી ઓડિટ અંગેના જે સંશય હતા તે અંગે ચર્ચા-વિચારણા કરવા તથા વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જીએસટી વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચેમ્બર ખાતે એક બેઠકનું આયોજન કરવાનું નક્કી કરેલ. આ જીએસટી વિભાગના અધિકારીશ્રીઓ શ્રી મનીષકુમાર, સંયુક્ત કમિશનરશ્રી (ઓડિટ), ડો. શ્રી રાજેશ નાગોરા, સંયુક્ત કમિશનરશ્રી (ઓડિટ), શ્રી જી.કે. જાલા, સહાયક કમિશનરશ્રી, રાજકોટથી પધારેલ હતા. ત્યારબાદ વેપાર-ઉદ્યોગ વચ્ચે જે અસમંજસ તથા ગેરસમજ હોય તે દૂર કરવા જામનગરના ઉદ્યોગકારો, મોટાં ઉદ્યોગગૃહો, વ્યવસાયકારો તથા ટેક્સ પ્રેક્ટિશનરો ઉપસ્થિત રહેલ હતા. ચેમ્બરના હાદેદારોશ્રીઓ તથા પેનલ ચેરમેનશ્રીઓ દ્વારા અધિકારીશ્રીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ.

આજની બેઠકના કસ્ટમ અને સેન્ટ્રલ જીએસટી પેનલ ચેરમેનશ્રી

ભરતભાઈ ઓઝાએ જામનગર ચેમ્બરનો પરિચય આપેલ હતો તથા સ્ટેટ જીએસટી પેનલના ચેરમેનશ્રી પંકજભાઈ વાધરે આજની બેઠકના આયોજનનો હેતુ સમજાવેલ હતો. જીએસટી કાયદો તા. ૦૧-૦૭-૨૦૨૦ થી અમલમાં આવેલ છે અને તેનો અમલ વેપારીઓ-ઉદ્યોગકારો કરે છે તેમાં વેપાર-ઉદ્યોગને ભરવાનાં થતાં જીએસટી-૧ તથા જીએસટી-૩બી પત્રક ભરેલ છે તે અંગેનાં ઓડિટ કરવામાં આવે છે તેની માહિતી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.

બેઠકની શરૂઆતમાં આસિ. કમિશનરશ્રી જી.કે. ઝાલાએ જણાવેલ કે કરદાતા તથા જીએસટી વિભાગ વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોય તે બાબત તેમનો સંપર્ક કરવા જણાવેલ તેમજ વધુમાં જણાવેલ કે વેટ કાયદામાં આકારણી પ્રથા હતી, ઓડિટ પ્રથા ન હતી પરંતુ તેમણે જણાવેલ કે જીએસટીમાં ઓડિટના કાયદા નવા છે, તેથી વ્યાપારીઓ-ઉદ્યોગકારોને મૂંઝવણ સહજ છે. દિવસે ને દિવસે જીએસટી વિભાગ પણ કાયદો સરળીકરણ કરવા જઈ રહેલ છે. વધુમાં પ્રશ્નો હોય તે માટે વિભાગને સીધા ફોન કરી શકાય છે. તેઓએ વ્યાપારીઓ તથા કરદાદાઓને સમયસર કર ભરી રિટર્ન ભરવા અનુરોધ કરેલ હતો. ત્યારબાદ ડૉ. રાજેશ નાગોર, સંયુક્ત કમિશનરશ્રી (ઓડિટ) દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું તેમજ શ્રી મનીષકુમાર સંયુક્ત કમિશનરશ્રી (ઓડિટ) દ્વારા કાયદાની જોગવાઈ બાબત ખૂબ જ સરળ ભાષામાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપેલ હતું, જેમાં

સરકારશ્રીના ઉદ્દેશ વન ટેક્સ, વન નેશન, વન માર્કેટનો છે. વેપાર-ઉદ્યોગ જે કર તથા રિટર્ન ભરે છે તે નિયમ અનુસાર છે કે નહિ તે માટે ઓડિટ કરવામાં આવે છે. વેપાર-ઉદ્યોગના કાયદા માટે છે.

બેઠકમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમનો અમાવેશ કરેલ, જેથી વ્યાપારી-ઉદ્યોગકારો, ટેક્સ પ્રેક્ટિશનરો તથા વ્યવસાયકારોને તેમના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવામાં સરળતા રહે. વધુમાં પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરતાં જણાવેલ કે જીએસટી વિભાગ દ્વારા જામનગર ખાતે કેમ્પનું આયોજન કરવા અનુરોધ કરેલ હતો. આ માટે કેમ્પ માટેનું આયોજન થાય ત્યારે જે લોકોને પ્રશ્નો હોય તે માટે ખાસ હાજરી આપવા સભાગૃહમાં અપીલ કરેલ હતી અન્યથા તેમની ફરિયાદો સ્વીકારવામાં નહિ આવે. વધુમાં જામનગર ઓફિસના અધિકારીશ્રીએ જણાવેલ કે તા. ૦૧-૦૧-૨૧થી શરૂ થયેલ નવી યોજના (ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ) વિશે માહિતી આપેલ તેમજ તે યોજનાનો લાભ લેવા અનુરોધ કરેલ.

બેઠકના અંતે ઉપસ્થિત અધિકારીઓને ચેમ્બરના હોદ્દેદારશ્રીઓના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ તથા માનદ-સહ-મંત્રીશ્રી કૃષ્ણલભાઈ વી. શેઠ દ્વારા આભારદર્શન કરવામાં આવેલ. સમગ્ર બેઠકનું સફળ સંચાલન માનદ મંત્રી શ્રી અક્ષતભાઈ વ્યાસે કરેલ હતું.

Vadodara Chamber of Commence Industry



31-10-2020: On National Unity Day, team VCCI visited Statue of Unity and were a part of the select gathering addressed by Hon'ble PM, Shri Narendra Modi.



28-12-2020 : "KhatMahurat" of installation of New Street light Poles in GIDC-Makarpura Estate, of the Rs.25 lakhs sanctioned grant received from M.P. quota of Smt. Ranjanben Bhatt, was held at the auspicious hands of our Hon'ble MLA & Minister of State, Govt. of Gujarat-Shri Yogeshbhai Patel & Hon'ble M.P. Smt. Ranjanben Bhatt with special presence of Dr. Vijay Shah, President, BJP, Vadodara City.



Jayaswal Enterprises Pvt. Ltd.®

AIREO

Complete Travel Solution

Our Service



Flight



Train



Bus



Hotels



Holidays



Top-up



Visa



Forex



Cruise



Entertainment



Make Your Holiday Memorable...

Call us now for
Corporate Travel Desk Management &
International & Domestic Tour Packages



aireo.in

holidays@aireo.in

+91 84608 33100 | +91 84608 33300

+91 922 711 4444 | +91 79 6190 1100

R ▶ A-85, 86 Pariseema Complex, C.G. Road
Ahmedabad-380 009. Gujarat (India).

C ▶ 2nd Floor, Shree Ganesh Avenue, Opp. D-Mart, L.B.S. Road
Bapunagar, Ahmedabad-380 024. Gujarat (India)



Action Taken

● કારોબારી સમિતિની મિટિંગમાં ખેડૂતોને તેમની કૃષિ જણસના પોષણક્ષમ ભાવ મળે તે સારું રજૂઆત કરવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને તા.૧૧-૧૧-૨૦૨૦ના રોજ રજૂઆત કરી રાજ્યમાં ખેડૂત ગ્રાહક બજારની સ્થાપના સારું ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં રિઝર્વેશન કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.

● કારોબારી સમિતિની મિટિંગમાં કચ્છ વિસ્તારને ફર્નિચર માટેના હબ તરીકે વિકસાવવા અંગે રજૂઆત કરવા જણાવવામાં આવ્યું હતું, જે અનુસંધાને તા.૧૨-૧૧-૨૦૨૦ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને કચ્છમાં ફર્નિચર ઉદ્યોગ અને રહેલી તકો તેમજ તેને વિકસાવવા માટે સરકારશ્રીની સહાયતા માટે વિનંતી કરતો પત્ર મોકલવામાં આવ્યો હતો.

● કારોબારી સમિતિની મિટિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે અનુસંધાને તા.૨-૧૧-૨૦૨૦ના રોજ મ્યુનિ. કમિશનર શ્રી મુકેશ કુમારને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં ચાલુ પ્રોસેસ હાઉસ અને ફેક્ટરીને દિવાળીના તહેવાર દરમ્યાન બાંધકામ બાબતે સીલન કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને તા.૧૧-૧૧-૨૦૨૦ના રોજ રજૂઆત કરવામાં આવી છે.

● કારોબારી સમિતિની મિટિંગમાં માનનીય ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને ચેમ્બરમાં બોલાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું અને સભ્યો પાસેથી ઊર્જા ક્ષેત્રના પ્રશ્નો મંગાવવા જણાવ્યું હતું. આના અનુસંધાને ઊર્જા તેમજ વૈકલ્પિક ઊર્જા જેવી કે સોલર વગેરે અંગેના પ્રશ્નો સભ્યો પાસેથી મંગાવી તેનું સંકલન કરવામાં આવ્યું છે, સાથોસાથ શ્રી સૌરભભાઈ પટેલને ચેમ્બરમાં આમંત્રણ આપવા અંગેની કાર્યવાહી ચાલુ છે.

● કારોબારી સમિતિની મિટિંગમાં શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવને તા.૩૦-૧૦-૨૦૨૦ના રોજ રજૂઆત કરવામાં આવી છે.

● વેપારીઓ તેમજ હોટલ રેસ્ટોરન્ટધારકો તરફથી તેમના ધંધાને

રાતના ૧૨-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા અંગેની રજૂઆત ચેમ્બરને મળેલ હતી, જે અનુસંધાને GCCI દ્વારા તા.૬-૧૧-૨૦૨૦ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અને તા.૧૧-૧૧-૨૦૨૦ના રોજ શ્રી રાજીવકુમાર ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.

● GCCIની રીજનલ ચેમ્બર તરફથી લગન-મરણ પ્રસંગમાં ૨૦૦ વ્યક્તિઓની છૂટ આપવા અંગેની રજૂઆત મળી હતી તેના અનુસંધાનમાં GCCI દ્વારા તા.૨૪-૧૦-૨૦૨૦ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલ અને તેનો સકારાત્મક નિર્ણય આવેલ છે.

● કારોબારી સમિતિની મિટિંગમાં શ્રી સુનીલભાઈ વડોદરિયા દ્વારા જે શહેરોમાં દૈનિક ૨૦થી ઓછા કોરોના કેસ હોય તેમાં ૨૦૦ વ્યક્તિઓને આમંત્રિત કરવા માટેની છૂટછાટ આપવા રજૂઆત કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ચેમ્બર દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

● આ ઉપરાંત તેમણે GWIL દ્વારા પાણી કનેક્શન માટે અન્ય વિભાગોની જેમ ડિપોઝિટ માટે બેંક ગેરંટી સ્વીકારવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. આ અંગે ચેમ્બર દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલ છે અને ફરી GWILને રજૂઆત કરી ફોલો-અપ કરવામાં આવી રહ્યું છે.

● શ્રી કિરીટભાઈ સોની દ્વારા મીઠા ઉદ્યોગના પ્રશ્નો અંગે ચેમ્બરમાં રજૂઆત કરવામાં આવેલ હતી, જે અંગે ચેમ્બર દ્વારા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે.

● શ્રી બિપેન્દ્રસિંહજી અને શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગત ઔદ્યોગિક એકમોને માલ્ટા SGST કન્સેશનના લાભ લેવા માટેની સમયમર્યાદા લંબાવવા માટે રજૂઆત કરવા જણાવ્યું હતું. આ અનુસંધાને ચેમ્બર દ્વારા ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસને રજૂઆત પાઠવેલ છે.

Representations

● 63 AAAની જોગવાઈઓ એફોર્સિબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે અમલી બનાવવા તેમજ GDCRમાં ફેરફાર કરી એફોર્સિબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં યુનિટ સેઝમાં ફેરફાર કરવા તેમજ Floor Hightની મર્યાદા હટાવવા વગેરે રિયલ એસ્ટેટના પ્રશ્નો અંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ રજૂઆત. (તા.૨૩-૧૦-૨૦૨૦)

● લગ્ન-મરણ પ્રસંગમાં ૨૦૦ વ્યક્તિઓની છૂટ આપવા બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ રજૂઆત. (તા.૨૪-૧૦-૨૦૨૦)

● દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વેપારીઓના જનરલ ઈન્વેસ્ટિગેશન આ સમય દરમ્યાન હાથ ન ધરવા અંગે ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સીસ શ્રી જે.પી. ગુપ્તાને પાઠવેલ રજૂઆત. (તા.૨૬-૧૦-૨૦૨૦)

● આગામી દિવાળીના તહેવારના દિવસોમાં દુકાનદારો અને ધંધાર્થીઓને રાતના ૧૨-૦૦ વાગ્યા સુધી ધંધો ચાલુ રાખવા અંગે મંજૂરી આપવા બાબતે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાને પાઠવેલ પત્ર. (તા.૨૭-૧૦-૨૦૨૦)

● નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ઓર્ડર અને CEPI સ્કોર અંગે વિસંગતતાઓ વિષે ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના સેક્રેટરી શ્રી આર. પી. ગુપ્તાને પાઠવેલ રજૂઆત. (તા.૨૮-૧૦-૨૦૨૦)

● GPCB દ્વારા હાલના તહેવારના દિવસોમાં તેમજ 'કોવિડ-૧૯'ને ધ્યાનમાં રાખી આગામી તહેવારના દિવસો દરમ્યાન ઉદ્યોગોને ક્લોઝરના આદેશ નહીં આપવા અંગે વિનંતી બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા GPCBના ચેરમેન શ્રી સંજીવકુમાર તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય

સચિવશ્રી એમ. કે. દાસને પાઠવેલ પત્ર. (તા.૨૯-૧૦-૨૦૨૦)

● GPCB દ્વારા હાલના તહેવારના દિવસોમાં તેમજ 'કોવિડ-૧૯' ને ધ્યાનમાં રાખી આગામી તહેવારના દિવસો દરમ્યાન ઉદ્યોગોને ક્લોઝરના આદેશ નહીં આપવા અંગે વિનંતી બાબતે પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારને પાઠવેલ પત્ર. (તા.૩૦-૧૦-૨૦૨૦)

● અમદાવાદ શહેરની GIDC વસાહતોમાં પ્રવેશતાં ભારે વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવા તેમજ વાહનોના પ્રવેશ માટે દાખલ કરવામાં આવેલ પરમિટ સિસ્ટમ નાબૂદ કરવા અંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવને પાઠવેલ રજૂઆત. (તા.૩૦-૧૦-૨૦૨૦)

● ભારતનાં વિભિન્ન પોર્ટ અને એરપોર્ટમાંથી આયાત-નિકાસના કસ્ટમ ડેટા પબ્લિશ ન કરવા અંગે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ શ્રી અમિત યાદવ તેમજ એડિશનલ DGFT શ્રી અનિલકુમાર ચૌધરીને પાઠવેલ પત્ર. (તા.૨-૧૧-૨૦૨૦)

● અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતાં સૂચનો બાબતે મ્યુનિ. કમિશનર શ્રી મુકેશકુમારને પાઠવેલ રજૂઆત. (તા.૨-૧૧-૨૦૨૦)

● અમદાવાદનાં હોટલ અને રેસ્ટોરન્ટને રાતના ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવા મંજૂરી આપવા બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમારને પાઠવેલ રજૂઆત. (તા.૬-૧૧-૨૦૨૦)

● GPCB/SEAC/SEIAAને ગુજરાતમાં હાલમાં કાર્યરત ઔદ્યોગિક એકમોને વિસ્તૃતીકરણ અને મોડર્નાઈઝેશન કરવા તેમજ નવા યુનિટ્સ સ્થાપવા માટેના પ્રતિબંધને દૂર કરવા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય

સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને પાઠવેલ રજૂઆત.
(તા.૭-૧૧-૨૦૨૦)

● ફેસલેસ અપીલ સ્કીમ-૨૦૨૦ અંતર્ગત કરદાતાઓને Personal hearingની તક આપવા બાબતે ભારત સરકારનાં માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને પાઠવેલ રજૂઆત (તા.૦૮-૧૧-૨૦૨૦)

● રાજ્યમાં ખેડૂત ગ્રાહક બજારની સ્થાપના સારું ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં રિઝર્વેશન બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ પત્ર (તા.૧૧-૧૧-૨૦૨૦)

● અમદાવાદમાં આવેલ ટેક્સટાઈલ અને અન્ય પ્રોસેસ હાઉસને સીલ કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ પત્ર (તા.૧૧-૧૧-૨૦૨૦)

● અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલ ઔદ્યોગિક એકમો માટે NOC/લાઈસન્સની પરવાનગી મેળવવા બાબતે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટને પાઠવેલ પત્ર (તા.૧૧-૧૧-૨૦૨૦)

● કચ્છ વિસ્તારને ફર્નિચર માટેના હબ તરીકે વિકસાવવા અંગેનાં સૂચનો બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ પત્ર (તા.૧૨-૧૧-૨૦૨૦)

● અમદાવાદમાં તા.૨૦-૧૧-૨૦૨૦ ના રોજ રાતના ૯.૦૦ વાગ્યાથી તા. ૨૩-૧૧-૨૦૨૦ના રોજ સવારના ૬.૦૦ વાગ્યા સુધી લાગુ કરવામાં આવેલ કરફ્યુ બાબતે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાંગલેને મોકલાવેલ રજૂઆત (તા.૨૦-૧૧-૨૦૨૦)

● ઊર્જા અંગેના પ્રશ્નો અંગે ગુજરાત સરકારના માનનીય ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને પાઠવેલ રજૂઆત. (તા.૨૦-૧૧-૨૦૨૦)

● Factories Act અંતર્ગત રજિસ્ટર થયેલ એકમોને AMC પાસેથી ફાયર NOC ફરજિયાત લેવાની જોગવાઈ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારને પાઠવેલ રજૂઆત (તા.૨૩-૧૧-૨૦૨૦)

● CEPI અંગેના મુદ્દા તેમજ NGTના ઓર્ડર અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે CPCBના સભ્ય સચિવ શ્રી અજય અગ્રવાલને પાઠવેલ પત્ર (તા.૨૫-૧૧-૨૦૨૦)

● ગુજરાતમાં Potato Research Centreના રિજિયોનલ સેન્ટરની સ્થાપના કરવા અંગે ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરને પાઠવેલ રજૂઆત (તા.૨૫-૧૧-૨૦૨૦)

● ‘કોવિડ-૧૯’ને ધ્યાનમાં રાખી Ministry of Corporate Affairs (MCA) અંતર્ગત CSRની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવા અંગે ભારત સરકારનાં માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને પાઠવેલ રજૂઆત (તા.૨૬-૧૧-૨૦૨૦)

● ‘કોવિડ-૧૯’ને ધ્યાનમાં રાખી Ministry of Corporate Affairs (MCA) અંતર્ગત CSRની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવા અંગે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંતોષકુમાર ગંગવારને પાઠવેલ રજૂઆત (તા.૨૭-૧૧-૨૦૨૦)

● અમદાવાદમાં આવેલ ઔદ્યોગિક એકમો માટે ફાયર NOC/લાઈસન્સની સમયમર્યાદા પાંચ વર્ષની કરવા બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારને મોકલાવેલ પત્ર (તા.૨૮-૧૧-૨૦૨૦)

● સરેરાશ દૈનિક ૨૦ કરતાં ઓછા કોવિડ પોઝિટિવ કેસ હોય તેવા જિલ્લામાં સામાજિક/લગ્નપ્રસંગોમાં ૨૦૦ વ્યક્તિ સુધીની છૂટ યથાવત્ રાખવા અંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ રજૂઆત (તા.૨૮-૧૧-૨૦૨૦)



SEKHANI

With Best
COMPLIMENTS



Celebrating
The fabric of life



SEKHANI

MANGAL TEXTILE MILLS (INDIA) PVT. LTD.

104, 123, GIDC Phase-1, Vatva, Ahmedabad, Gujarat-382445

● ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગત ઔદ્યોગિક એકમોને મળતા SGST કન્સેશનના લાભ લેવા માટેની સમય મર્યાદા લંબાવવા બાબતે ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસને પાઠવેલ રજૂઆત (તા.૨૮-૧૧-૨૦૨૦)

● Pre-Budget Memorandum ૨૦૨૧-૨૨ અંગે ભારત સરકારનાં માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને પાઠવેલ સૂચનો (તા.૩૦-૧૧-૨૦૨૦)

● દરિયાઈ વહાણ પરિવહન (Coastal Shipping)ને ગુજરાતમાં વિકસાવવામાં પડતી Shipping Corporation of India (SCI)ને લગતી મુશ્કેલીઓ અને નિરાકરણ માટેનાં સૂચનો અંગે ભારત સરકારના માનનીય શિપિંગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાને પાઠવેલ પત્ર (તા.૩૦-૧૧-૨૦૨૦)

● ‘કોવિડ-૧૯’ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઈન્સ્યોરન્સ કંપનીઓને મદદરૂપ બનવા માટેની માર્ગદર્શિકા આપવા અંગે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. સુભાષ ખૂંટિયાને પાઠવેલ પત્ર (તા.૨-૧૨-૨૦૨૦)

● Contract Labour (Regulation and Abolition) (Gujarat Amendment) Rules, ૨૦૨૦ અંગે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાને પાઠવેલ રજૂઆત (તા.૨-૧૨-૨૦૨૦)

● જે ફેક્ટરીઓ ફાયર સેફ્ટીના કાયદાઓનું પાલન કરવાની બાંધારી આપતો અંડરટેકિંગ આપવા સંમત હોય તેમને સમયમર્યાદા લંબાવી આપવા અંગે ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ગુજરાત સરકારને પાઠવેલ રજૂઆત. (તા.૨-૧૨-૨૦૨૦)

● Treatment, Storage and Disposal Facilities (TSDF) સાઈટને ચાલુ કરવા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવા બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ શ્રી એ.વી. શાહને પાઠવેલ પત્ર (તા.૫-૧૨-૨૦૨૦)

● Floursના classification અંગેના પ્રશ્નના કારણે રિકવરી એક્શન તેમજ અરેસ્ટની ધમકી ન આપવા ફિલ્ડ ઓફિસરોને સૂચના આપવા અંગે ગુજરાતના ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સીસ શ્રી જે.પી. ગુપ્તાને પાઠવેલ રજૂઆત (તા.૦૭-૧૨-૨૦૨૦)

● CEPI અંગેના મુદ્દા તેમજ NGTના ઓર્ડર અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવા અને રૂબરૂ ચર્ચા માટે મિટિંગનું આયોજન કરી સમય ફાળવવા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવકુમાર ગુપ્તાને પાઠવેલ પત્ર (તા.૦૮-૧૨-૨૦૨૦)

● CPC અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવા તેમજ Faceless એસેસમેન્ટ અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ શ્રી અમિત જૈનને પાઠવેલ રજૂઆત. (તા.૦૮-૧૨-૨૦૨૦)

● ક્રેડિટ લિન્કડ કેપિટલ સબસિડી સ્કીમ (Credit Linked Capital Subsidy Scheme)ને લંબાવવા અંગે ભારત સરકારના માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસીઝના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીને પાઠવેલ પત્ર (તા.૧૧-૧૨-૨૦૨૦)

● વિવાદ સે વિશ્વાસ એક્ટ-૨૦૨૦ અંતર્ગત ઈન્કમેટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમયમર્યાદા લંબાવવા અંગે ભારત સરકારનાં માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને પાઠવેલ રજૂઆત (તા.૧૪-૧૨-૨૦૨૦)

Endowing Colours to Life



Aries Group has spread its colorful aura across the world like a true Arian. Over the past 30 years it has emerged, with great force. Today, it stands as India's leading Exporter & Manufacturer of Dyestuffs for leather & textile industries and is recognized by the Government as a Star Export House in India.

Aries Endows Colours to Life by reaching out to the people through various Products and Applications like:

Acid Dyes : Leather, Wool, Polyester, Silk, Jute & Nylon

Direct Dyes : Leather, Cotton & Paper

Reactive Dyes : Cotton & Hosiery

Metal Complex Dyes : Leather, Wool, Silk, Jute, Nylon & Paper

Leather Dyes : Leather



ARIES GROUP

ARIES DYE-CHEM INDUSTRIES

(A Government Recognised Star Export House)



ARIES ORGANICS PVT. LTD.

(An 100 % EOU)



ARIES COLOR CHEM PVT. LTD.

(SEZ Unit) Z-29 & Z-30, Dahej SEZ, Part-I, Dahej, Dist. Bharuch, India

C-1/260, Phase-II, G.I.D.C., Vatva,
Ahmedabad - 382 445, India.
Phone : +91-99099 69791

info@ariesgroup.in
www.ariesgroup.in



Focused on Healthcare, Power and Gas – necessities without which modern life is unimaginable.



CIMS HOSPITAL



CIMS NORTH



CIMS EAST



CIMS CANCER



WEST CIMS

CIMS EAST HOSPITAL (NON-COVID) AHMEDABAD

A Safe, Separate Building
3,00,000 Sq.ft and Massive Basements
Over 3.5 Acres

24X7 DESTINATION FOR
ALL MULTI-SPECIALITY SERVICES



GOLD SEAL OF QUALITY CARE
JOINT COMMISSION INTERNATIONAL (JCI) - USA
ACCREDITED ONLY MULTI-SPECIALTY HOSPITAL IN AHMEDABAD CITY



CIMS Hospital
Off Science City Road, Sola, Ahmedabad - 380060
Ph.: +91-79-2771 2771-72 Fax: +91-79-2771 2770
Email: info@cims.org | www.cims.org



JCI (USA)



NABH



NABL
Certificate No. MC-3049



ACC
International
Centers Of Excellence

AMBULANCE : +91-98 24 45 00 00 | EMERGENCY : +91-97 23 45 00 00 | 24 X 7 MEDICAL HELP LINE +91-70 69 00 00 00

